

## મુદ્દા નં.૦૨ :—સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો :—

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
(૧)	ટેલ્યુટી મ્યુનિ.કમિશનર	<ul style="list-style-type: none"> <li>➢ સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફ તરીકે સમગ્ર ઝોનને નેતૃત્વ પરું પાડવું. તેમજ તાબા હેઠળના અધિકારી/કર્મચારીઓ પાસેથી સેન્ટ્રલ ઝોનને લગતી તમામ પ્રકારની કામગીરીની દેખરેખ રાખી માર્ગદર્શન પૂરું પાડવું.</li> <li>➢ ઝોનના ઝોનલ ચીફ તરીકે તેઓને વહીવટી સત્તાઓ પ્રદાન કરવામાં આવી છે.</li> </ul>
(૨)	આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનર	<ul style="list-style-type: none"> <li>➢ સેન્ટ્રલ ઝોનનાં વહીવટી વિભાગનાં વડા તરીકે ફરજ બજાવવી, જેમાં સેન્ટ્રલ ઝોનનાં ઈજનેરી વિભાગ સિવાયની તમામ વિભાગ જેવાકે, આકારણી વિભાગ, પ્રોફેશનલ કાયદા / લિગલ વિભાગ, મહેકમ વિભાગ / વહીવટી વિભાગ / ગુમાસ્તાધારા વિભાગ, હિસાબી વિભાગ, જમીન મિલકત તથા પે એન્ડ પાર્ક રીકવરીની તમામ કામગીરી ઉપર દેખરેખ રાખવી અને તાબા હેઠળનાં સ્ટાફ મારફત કામગીરી કરાવવી.</li> <li>➢ ઝોનના આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનરશી તરીકે તેઓને વહીવટી તેમજ આર.ટી.આઈ. એક્ટ હેઠળ અપીલ અધિકારીની સત્તાઓ પ્રદાન કરવામાં આવી છે તેઓના કાર્યક્ષેત્ર હેઠળ સીટી સર્વે વોર્ડ નં.૧,૨,૩,૪,૫,૬,૭,૮,૯,૧૦,૧૧અને ૧૨ નો સમાવેશ થાય છે.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફિન વખતે સૌંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૩)	કાર્યપાલક ઈજનેર	<ul style="list-style-type: none"> <li>➢ સેન્ટ્રલ ઝોનનાં ઈજનેરી વિભાગના વડા તરીકેની ફરજ બજાવવી, જેમાં સેન્ટ્રલ ઝોનનાં ઈજનેરી વિભાગની તમામ કામગીરી ઉપર દેખરેખ રાખવી અને તાબા હેઠળનાં સ્ટાફ મારફત કામગીરી કરાવવી. ઝોનના કાર્યપાલક ઈજનેર તરીકે તેઓને વહીવટી તેમજ આર.ટી.આઈ. એક્ટ હેઠળ અપીલ અધિકારીની સત્તાઓ પ્રદાન કરવામાં આવી છે તેઓના કાર્યક્ષેત્ર હેઠળ સીટી સર્વે વોર્ડ નં.૧,૨,૩,૪,૫,૬,૭,૮,૯,૧૦,૧૧અને ૧૨ નો સમાવેશ થાય છે.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફિન વખતે સૌંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૪)	૩. ઈજનેર	<ul style="list-style-type: none"> <li>➢ સબ ઝોન વિસ્તારમાં કાર્યક્ષેત્ર હેઠળનાં તમામ આસી./જુની. ઈજનેરોને સૌંપવામાં આવેલ વિવિધ ખાતાઓને લગતી કામગીરીનું સુપરવિઝન તેમજ સંકલનની કામગીરી.</li> <li>➢ વધુમાં કાર્યપાલક ઈજનેરશી તરફથી મળતાં કોમન કામોનું સંકલન.</li> <li>➢ આરટીઆઈ એક્ટ અન્વયે જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજો અદા કરવાના કામો.</li> <li>➢ મહિનામાં એક વાર આરોગ્ય ખાતામાં જુદા જુદા ઝોનમાં રાત્રિ સ્કેપીંગ / બ્રશીંગ / લાઈટીંગની કામગીરીનું સુપરવિઝન.</li> <li>➢ પોતાના હાથ નીચેનાં કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.</li> <li>➢ લીકેજ દુરસ્ત તેમજ ગંદા પાણીને લાગતા કામોની કામગીરી.</li> <li>➢ પાણીનાં નવા નળ કનેક્શનો / ફ્રી કનેક્શનો આપવાની કામગીરી.</li> <li>➢ ઇનેજના નવા કનેક્શનો આપવાની કામગીરી.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફિન વખતે સૌંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
<b>શહેર વિકાસ વિભાગ</b>		
(૧)	આસી./જુની.ઇજનેર/સુપરવાઈઝર	<ul style="list-style-type: none"> <li>➢ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ઝોનનાં કાર્યક્ષેત્ર અર્થત આવતી વિકાસ પરવાનગીની ફાઈલો મંજૂર કરવાની કાર્યવાહી કરવી.</li> <li>➢ સમયાંતરે મુખ્ય કચેરી, સરકારી તથા અન્ય કચેરીએથી માંગવામાં આવતી માહિતી આપવી.</li> </ul>

કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
	<ul style="list-style-type: none"> <li>➢ અનગ્રથિકૃત બાંધકામને નોટીસ આપી દૂર કરવાની કામગીરી.</li> <li>➢ મિલ્કતોને રીપેરીંગ કરવાની મંજુરી આપવા બાબતની કાર્યવાહી કરવી.</li> <li>➢ ટેમ્પરરી સ્ટ્રોકચર મંજુર કરવાની કામગીરી કરવી.</li> <li>➢ આર.ટી. આઈ અંતર્ગત માહિતી તૈયાર કરી પુરી પાડવી.</li> <li>➢ ભયજનક / બિસમાર મિલ્કતોને ચકાસણી કરી નોટીસ આપવાની તથા તેને સંલગ્ન કામગીરી.</li> <li>➢ વસવાટની પરવાનગી આપવા સંદર્ભની કામગીરી.</li> <li>➢ અનામત પ્લોટમાં દબાજા/ગેરકાફેસર બાંધકામ ન થાય તેની તકેદારી તથા પગલાં લેવા.</li> <li>➢ ગૃડા એક્ટ-૨૦૨૨ અંતર્ગત મિલ્કત રેંયુલરાઈઝેશન કરવાની કામગીરી.</li> <li>➢ I.C. નાં નાંખાની વસુલાત.</li> <li>➢ જાહેર જનતાની વિવિધ મિલ્કતોની ટાઉન પ્લાનીગ તથા શહેર વિકાસને લગતા મુદ્દાઓની પુછ્છતાછનો નિકાલ,</li> <li>➢ ગામતળ વિસ્તારમાં મધ્યસ્થ ટાઉન પ્લાનીગ વિભાગનાં દેખરેખ હેઠળ રસ્તાની લાઈનદોરીનાં અમલીકરણની કામગીરી.</li> <li>➢ શહેરવિકસમાં નડતરરૂપ ઝુંપડાઓનાં સ્થળાંતરની કામગીરી.</li> <li>➢ પુર કે કુદરતી આફત વખતે સોંપવામાં આવતી કામગીરી.</li> </ul>

### લોકસેવા વિભાગ

(૧)	આસી./જુની.ઇઝનેર/સુપરવાઈઝર	<ul style="list-style-type: none"> <li>➢ નવા રસ્તા મેટલ ગ્રાઉન્ડીંગ, કારપેટ / રીકારપેટ કરવાના કામનાં અંદાજ તૈયાર કરવા, ટેન્ડર કામગીરી તથા સ્થળ પર રસ્તા બનાવવાનાં કામનું સુપરવિઝન.</li> <li>➢ હયાત રસ્તાનાં મરામત / નિભાવની કામગીરી.</li> <li>➢ નવા ફુટપાથ બનાવવાનાં અંદાજ / ટેન્ડરની કામગીરી તથા નિભાવ અને તેના સુપરવિઝન.</li> <li>➢ રોડ મટીરીયલ્સ પ્રોક્યોર કરવાની કામગીરી.</li> <li>➢ રસ્તા અને ફુટપાથ, વોટર ટેબલ સંબંધિત આવેલ ફરિયાદનાં નિકાલની કામગીરી.</li> <li>➢ થયેલ કામોનાં બીલ બનાવવા, ઓડિટ ઓફ્જેક્શનનાં નિકાલની કામગીરી.</li> <li>➢ વોર્ડ સમિતિને લગતી કામગીરી.</li> <li>➢ રોડ કીવાઈડર અને ટ્રાફીક સર્કલના રીપેરીંગની કામગીરી.</li> <li>➢ ઝોનમાં સોંપવામાં આવેલ વિસ્તાર વાઈઝ રસ્તા / ફુટપાથ પર છેપીંગ કરવા તથા માટીનાં ઢગલા ઉપાડવાની કામગીરી.</li> <li>➢ રસ્તા મેઈન્ટેનન્સ / પેચવર્ક કરવાની કામગીરી.</li> <li>➢ વરસાદી જાળીયા સફાઈ કામગીરી, ફુટપાથ રીપેરીંગ કરવાની કામગીરી, ખૂલ્લી ગટર, ફાડચા સફાઈની કામગીરી, રસ્તા સાઈડ પરનાં જંગલ કટીંગની કામગીરી.</li> <li>➢ સ્ટ્રોમ ટ્રેનેજ લાઈનના નિભાવની કામગીરી જેવી કે રીપેરીંગ, લાઈનોની સાફ્સફાઈ ( ડીસલ્ટીંગ), (રીવર ફલ ગેટોનાં ઓપરેશન મેઈન્ટેનન્સની કામગીરી) ડીવોટરીંગ પંપો ચલાવવાની કામગીરી – નિભાવણીની કામગીરી, જાળીયા તથા મેનહોલ ખરીદવા વિગેરે તમામ કામગીરી.</li> <li>➢ રાઈટ ટૂ ઇન્ફ્રાશન એક્ટની અરજીઓના નિકાલની કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી/ કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન – હાજરી નિયંત્રણ.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૨)	ટેકનીકલ આસી.	<ul style="list-style-type: none"> <li>➢ ઝોનમાં આવેલ સોંપવામાં આવેલ વિસ્તાર વાઈઝ રસ્તા / ફુટપાથ પર છેપીંગ કરવા તથા માટીનાં ઢગલા ઉપાડવાની કામગીરી.</li> <li>➢ રસ્તા મેઈન્ટેનન્સ / પેચવર્ક કરવાની કામગીરી.</li> <li>➢ વરસાદી જાળીયા સફાઈ કામગીરી, ફુટપાથ રીપેરીંગ કરવાની કામગીરી, ખૂલ્લી ગટર, ફાડચા સફાઈની કામગીરી.</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<ul style="list-style-type: none"> <li>➢ ઉપલા અધિકારી ધ્વારા સોંપવામાં આવે તેવી અન્ય કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>

### પાણી વિભાગ

(૧)	આસી./જૂની.ઇજનેર/સુપરવાઈઝર	<ul style="list-style-type: none"> <li>➢ જોન વિસ્તારનાં સોસાયટી, ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણીની નળિકા નાંખવાનું કામ.</li> <li>➢ લીકેજ દુરસ્ત તેમજ ગંદા પાણીને લગતા કામોની કામગીરી.</li> <li>➢ પાણીનાં નવા નળ કનેક્શનો / ફી કનેક્શનો આપવાની કામગીરી.</li> <li>➢ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલની કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન – હાજરી નિયંત્રણ.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૨)	ટેકનીકલ આસી.	<ul style="list-style-type: none"> <li>➢ લીકેજ દુરસ્ત તેમજ ગંદા પાણીને લગતા કામોની કામગીરી.</li> <li>➢ પાણીનાં નવા નળ કનેક્શનો / ફી કનેક્શનો આપવાની કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ.</li> <li>➢ ઉપલા અધિકારી ધ્વારા સોંપવામાં આવે તેવી અન્ય કામગીરી.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૩)	લીકેજ ઈન્સ્પેક્ટર/ ફીટર ઈન્સ્પેક્ટર (ત્રીજી શ્રેણી કલાર્ક)	<ul style="list-style-type: none"> <li>➢ ફીલ્ડ વિઝિટ દરમાન લીકેજ તથા ગંદા પાણીને લગતી મળેલ ફરીયાદ સંદર્ભે દુરસ્તી તેમજ ગંદા પાણી ને લગતી કામગીરી પૂર્ણ કરી ફરીયાદનો નિકાલ કરવો.</li> <li>➢ નવા નળ / ફી કનેક્શન આપવાની કામગીરી.</li> <li>➢ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલની કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>

### હાઉસીંગ વિભાગ

(૧)	આસી./જૂની.ઇજનેર/સુપરવાઈઝર	<ul style="list-style-type: none"> <li>➢ વિવિધ પ્રકારના મ્યુ.બિલ્ડીંગનાં અંદાજ બનાવવાની કામગીરી, ટેન્ડરની કામગીરી, ચાલુ કામો પર દેખરેખ, સુરત મહાનગરપાલિકાની માલિકીની મિલકતોની નિભાવની કામગીરી.</li> <li>➢ મફત પે એન્ડ યુઝ ટોઈલેટ બનાવવા સંબંધિત કામગીરી.</li> <li>➢ જાહેર પ્રસંગોની ઉજવણી માટે આનુસંગિક વ્યવસ્થા કરવાની કામગીરી.</li> <li>➢ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલની કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ.</li> <li>➢ નિયંત્રણ વિસ્તારમાં શહેર બાગ–બગીચા, સ્નાનાગરમાં સિવીલ કામો તથા મેન્ટેનન્સની કામગીરી.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૨)	ટેકનીકલ આસી.	<ul style="list-style-type: none"> <li>➢ ચાલુ કામોની સાઈટ પર દેખરેખ.</li> <li>➢ ઉપલા અધિકારી ધ્વારા સોંપવામાં આવે તેવી અન્ય કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ.</li> <li>➢ ઉત્સવ – ઉજવણી કાર્યક્રમની વ્યવસ્થા.</li> <li>➢ નિયંત્રણ વિસ્તારમાં શહેર બાગ–બગીચા, સ્નાનાગરમાં સિવીલ કામો તથા મેન્ટેનન્સની કામગીરી.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>

### સ્ટ્રોમ ટ્રેનેજ વિભાગ

(૧)	જૂની.ઇજનેર	<ul style="list-style-type: none"> <li>➢ સમગ્ર જોન વિસ્તારનાં સ્ટ્રોમ ટ્રેઇન લાઈનોનાં અંદાજો બનાવવા – ટેન્ડરો મંગાવવા, મંજુર કરાવવા, કોન્ટ્રાક્ટ સોંપી સ્થળ કામગીરીનું સુપરવિઝન,</li> </ul>
-----	------------	---

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<p>માપણી, રનીગ તથા ફાઈનલ બીલો બનાવવા, સમગ્ર ઝોન વિસ્તારમાં મિલ્ક્ટોની ડ્રેનેજ કનેક્શનની મંજૂરી આપવી, ઓડીટ – સીક્યોરીટી ડીપોઝીટ છુટી કરવા સુધીની તમામ કાર્યવાહી કરવાનું તમામ પ્રકારની માહિતી આપવાનું, આ તમામ સ્ટોર્મ ડ્રેઇન લાઈનોનાં મરામત.</p> <ul style="list-style-type: none"> <li>➢ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલની કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન – હાજરી નિયંત્રણ.</li> <li>➢ વરસાદી ગટરોની મરામત, નિભાવની ડિસિલ્ટીગની કામગીરી.</li> <li>➢ પ્રિ-મોન્સુન કામગીરી.</li> <li>➢ ફલ્ડગોટ ઓપરેશન / મેન્ટેનન્સની કામગીરી.</li> <li>➢ આપણિ વ્યવસ્થાપન.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સૌપવામાં આવતી વધારાની કામગીરી.</li> <li>➢ સાઈટ પર સ્ટોર્મ લાઈનોનાં કામગીરી પર સુપરવિઝન – સીમેન્ટ તથા અન્ય મટીરીયલ્સનું સ્ટોક રસ્ટીસ્ટર બનાવવાની કામગીરી.</li> <li>➢ ઉપલા અધિકારી ધ્વારા સૌપવામાં આવે તેવી અન્ય કામગીરી.</li> <li>➢ નીચાણ વાળા વિસ્તારમાં ભરાતા પાણીનું ડીવોટરીંગ કરવાનું કામ.</li> <li>➢ ઉપરવાસ માંથી ડેમમાં છોડવામાં આવતા પાણીના કારણે નદીમાં વધતા પાણી અને આવતા પૂરનું નિયંત્રણ કરવાની કામગીરી.</li> <li>➢ નીચાણવાળી વિસ્તારની ઝુપડપડીમાં ભરાતા પાણી દરમિયાન સર્વ કરી તેઓને સલામત સ્થળો સ્થળાંતર કરવાની કામગીરી.</li> </ul>
		<b>લાઈટ વિભાગ</b>
		<p>સુરત મહાનગરપાલિકામાં સેન્ટ્રલ ઝોન લાઈટ ખાતામાં ૦૧ (એક) ડેયુટી ઇલે.૧૪૩૨,૦૧ (એક) જુની.૧૪૩૨,૦૧ (એક) મેન્ટન્ટે.આસી. (ઇલે.), ૦૩ (ત્રણ) ઈસ્ટ કલાસ ઈલેક્ટ્રીકલ સુપરવાઈઝર, ૦૫ (પાંચ) ઈલેક્ટ્રીકલ વાયરમેન, ૦૭ (સાત) તાલીમાર્થી ઈલેક્ટ્રીકલ વાયરમેન, ૦૧ (એક) પ્લાન્ટ એન્ડ સાઉન્ડ લાઈટ ઓપરેટર, ૦૬ (છ) બેલદાર તથા ૦૧ (એક) તાલીમાર્થી બેલદાર ફરજ બજાવી રહ્યા છે. લાઈટ ખાતાની કામગીરીમાં સેન્ટ્રલ ઝોનના કાર્યક્ષેત્રમાં આવતી મહાનગરપાલિકા સંચાલિત તમામ મિલ્ક્ટો/બિલ્ડીગોનાં ઈલેક્ટ્રીકલને લગતી કામગીરીનું મરામત અને નિભાવની કામગીરી કરવામાં આવે છે.</p>
(૧)	આસી. ઇન્નેર (ઇલે.)/જુની.૧૪૩૨ (ઇલે.)	<ul style="list-style-type: none"> <li>➢ સમગ્ર ઝોન વિસ્તારની સ્ટ્રીટ લાઈટોની મરામત, નિભાવની કામગીરીનું દેખરેખ તથા નવા સ્ટ્રીટલાઈટ પોલ ઉલ્લા કરવાના કામે અંદાજો રજુ કરવા.</li> <li>➢ કોન્ટ્રાક્ટથી સૌપી સ્થળ ઉપર સુપરવિઝન તથા એનજી બીલોની ચૂકવણી તથા મ્યુ.મિલ્ક્ટોનાં મરામત નિભાવ સહિતની તમામ લાઈટ ખાતાની કામગીરી.</li> <li>➢ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલની કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન – હાજરી નિયંત્રણ.</li> <li>➢ ઉત્સવ-ઉજવણી કાર્યક્રમની વ્યવસ્થા.</li> <li>➢ નિયંત્રણ વિસ્તારમાં સુ.મ.પા.ની મિલ્ક્ટો, જાહેર બાગ-બગીચા, સ્નાનાગર, સ્ટ્રીટ ફાઉન્ડેનની કામગીરી.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સૌપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૨)	ઇલે. સુપરવાઈઝર / મે.આસી.(ઇલે.)	<ul style="list-style-type: none"> <li>➢ સ્ટ્રીટ લાઈટ મરામત- નિભાવની કામગીરીનું સુપરવિઝન, ટી. પી. રસ્તા ઉપર નવા સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવાના કામે અંદાજ બનાવી જે તે સ્ટ્રીટ લાઈટ પોલ ઉલ્લા કરવાની કામગીરીનું સુપરવિઝન સહિતની કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીની કામગીરી / હાજરી / વર્તણૂંક બાબતે અસરકારક સુપરવિઝનની કામગીરી તથા હાજરી નિયંત્રણ.</li> <li>➢ ઉત્સવ – ઉજવણી કાર્યક્રમની વ્યવસ્થા.</li> <li>➢ નિયંત્રણ વિસ્તારમાં સુ.મ.પા.ની મિલ્ક્ટો, જાહેર બાગ-બગીચા, સ્નાનાગર, સ્ટ્રીટ ફાઉન્ડેન ની કામગીરી.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સૌપવામાં આવતી વધારાની કામગીરી.</li> <li>➢ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવાની કામગીરી તથા સુપર વિઝન તથા હાઉસીંગ મેન્ટન્ટેનન્સ, સ્ટોક મેન્ટેનન્સ સહિતની કામગીરી સુપરવિઝનની કામગીરી.</li> </ul>
(૩)	વાયરમેન	<ul style="list-style-type: none"> <li>➢ સ્ટ્રીટ લાઈટ મેન્ટેનન્સનાં કામે રાત્રે ચેકીંગની કામગીરી – મ્યુ.</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<p>મિલ્કટોમાં મરામત / વાયરીગને લગતી કામગીરી – ટોરેન્ટ / DGVCL સાથે સંકલનની કામગીરી – તથા અન્ય ખાતા તરફથી સોંપવામાં આવતી તમામ કામગીરી.</p> <p>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</p>
<b>દબાણ વિભાગ</b>		
(૧)	આસી.ઈજનેર/ ટેક.આસી	<p>➢ જાહેર રસ્તા પરનાં દબાણ દુર કરવાની તથા શહેરવિકાસ ખાતાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની કામગીરી તથા અધિકારીશ્રીઓની સુચનાઓનું વખતોવખત પાલન કરવાની કામગીરી.</p> <p>➢ રાઇટ ટુ ઈન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલની કામગીરી.</p> <p>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ.</p> <p>➢ ઉપલા અધિકારી ધ્વારા સોંપવામાં આવે તેવી અન્ય કામગીરી.</p> <p>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</p> <p>➢ હોકિંગ ઝોનનો અમલ / લાઈસન્સ ફાળવણી.</p>
<b>આરોગ્ય તથા વી. બી. ડી. સી. વિભાગ</b>		
(૧)	નાયબ આરોગ્ય અધિકારી	<p>➢ સમગ્ર ઝોનમાં આરોગ્યલક્ષી કામગીરીઓ અંગે તમામ વોર્ડ તથા વાહક જનિત રોગ નિયંત્રણ યુનિટની કામગીરીનું સુપરવિઝન અને વહીવટી કામગીરી.</p> <p>➢ પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.</p> <p>➢ જાહેર જાજરુ/પેશાબદાનીની સફાઈ ની કામગીરી</p> <p>➢ જાહેર મનોરંજનના સ્થળો જેવા કે સિનેમા ગુહ, નાટ્યગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ</p> <p>➢ રોગ ચાળા અંગોની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીકે જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી.</p> <p>➢ ઈ-ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળના અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી.</p> <p>➢ નાગરીક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી ફરિયાદોની ૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા</p> <p>➢ નાગરિકોને મહાનગરપાલિકાના સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકાર પત્ર</p> <p>➢ દરેક ઝોનમાં રોજ રોજ પાણીનાં નમુના એક્સિટ કરી કેમીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પૃથ્વીકરણ માટે નમુના લેબોરેટરીમાં મોકલવાની કામગીરી કરી તેમજ ગંદા પાણીની ફરિયાદોની ૨૪ કલાકમાં નિકાલ કરવાની વિશિષ્ટ પ્રથા</p> <p>➢ આરટીઆઈ એક્ટ અન્યથે જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજો અદા કરવાની કામો.</p> <p>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</p>
(૨)	આસી. જંતુનાશક અધિકારી	<p>➢ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વાહક જનિત રોગ નિયંત્રણ અંગોની કામગીરીનું મોનીટરીગ તેમજ સુપરવિઝન</p> <p>➢ રાઇટ ટુ ઈન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલની કામગીરી</p> <p>➢ પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.</p> <p>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</p>
(૩)	મુખ્ય આરોગ્ય નિરીક્ષક	<p>➢ સમગ્ર ઝોન વિસ્તારમાં આરોગ્યલક્ષી તમામ કામગીરી કરાવવાની.</p> <p>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન – હાજરી નિયંત્રણ.</p> <p>➢ સાફ સફાઈની કામગીરી નું નિરીક્ષણ</p> <p>➢ જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવવો.</p>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<ul style="list-style-type: none"> <li>➢ ધન કચરાનું એકન્ટિકરણ, પરિવહન અને આખરી નિકાલ કામગીરી નું નિરીક્ષણ</li> <li>➢ મરેલા જાનવરો(નાના અને મોટા) નો નિકાલની વ્યવસ્થા.</li> <li>➢ ગલી-ટ્રેપ ચોકીંગ દુર કરવાની કામગીરી</li> <li>➢ ખાળકુવા સફાઈ, જાજરુ ગલી સફાઈ, વપરાશી ફૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાના કલોરીન ટેસ્ટ ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા</li> <li>➢ ખાણી પીણીની હોટેલ, લારી ગલ્લા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી જાહેર જાજરુ / પેશાબદાનીની સફાઈ ની કામગીરી</li> <li>➢ જાહેર મનોરંજનના સ્થળો જેવા કે સિનેમા ગૃહ, નાટ્યગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ</li> <li>➢ રોગ ચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીક જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી. ઈ-ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળના અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી.</li> <li>➢ નાગરીક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી ફરિયાદોની ૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા</li> <li>➢ નાગરિકોને મહાનગરપાલિકાના સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકાર પત્ર</li> <li>➢ દરેક ઝોનમાં રોજે રોજ પાણીનાં નમુના એકત્રિત કરી કેમીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પૃથ્વેકરણ માટે નમુના લેબોરેટરીમાં મોકલવાની કામગીરી કરી તેમજ ગંદા પાણીની ફરીયાદોની ૨૪ કલાકમાં નિકાલ કરવાની વિશિષ્ટ પ્રથા.</li> <li>➢ રાઈટ ટૂ ઈન્ફર્મેશન એકટની અરજીઓના નિકાલની કામગીરી</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૪)	આરોગ્ય નિરીક્ષક	<ul style="list-style-type: none"> <li>➢ સોપેલ વોડી/વિસ્તારની આરોગ્યલક્ષી તમામ કામગીરી કરાવવાની તથા યુનીટ ખાતેનાં કર્મચારીઓ પાસે તમામ પ્રકારની કામગીરી કરાવવાની, રાત્રિ છેપીંગ / ભર્શીંગ કામગીરીનું સુપરવિઝન તેમજ વહીવટી કામગીરી</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન – હાજરી નિયંત્રણ</li> <li>➢ સાફ સફાઈની કામગીરી</li> <li>➢ જરૂરીયાતના સ્થળો જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવવો.</li> <li>➢ ધન કચરાનું એકન્ટિકરણ, પરિવહન અને આખરી નિકાલ કામગીરી</li> <li>➢ મરેલા જાનવરો(નાના અને મોટા) નો નિકાલ</li> <li>➢ ગલી-ટ્રેપ ચોકીંગ દુર કરવાની કામગીરી</li> <li>➢ ખાળકુવા સફાઈ, જાજરુ ગલી સફાઈ</li> <li>➢ વપરાશી ફૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાના કલોરીન ટેસ્ટ</li> <li>➢ ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા</li> <li>➢ ખાણી પીણીની હોટેલ, લારી ગલ્લા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી</li> <li>➢ જાહેર જાજરુ/પેશાબદાનીની સફાઈ ની કામગીરી</li> <li>➢ જાહેર મનોરંજનના સ્થળો જેવા કે સિનેમા ગૃહ, નાટ્યગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ</li> <li>➢ રોગ ચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીક જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી.</li> <li>➢ ઈ-ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળના અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી.</li> <li>➢ નાગરીક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<p>ફરિયાદોની ૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા</p> <ul style="list-style-type: none"> <li>➢ નાગરિકોને મહાનગરપાલિકાના સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકાર પત્ર</li> <li>➢ દરેક જોનમાં રોજ રોજ પાણીનાં નમુના એકનિત કરી કેમીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પૃથ્વેકરણ માટે નમુના લેબોરેટરીમાં મોકલવાની કામગીરી કરી તેમજ ગંદા પાણીની ફરિયાદોની ૨૪ કલાકમાં નિકાલ કરવાની વિશિષ્ટ પ્રથા</li> <li>➢ રાઇટ ટુ ઇન્ફર્મેશન એકટની અરજીઓના નિકાલની કામગીરી</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૫)	મદદનીશ આરોગ્ય નિરીક્ષક	<ul style="list-style-type: none"> <li>➢ આરોગ્યલક્ષી તમામ કામગીરી તેમજ એ. આઈ.ઓ. શ્રી તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટરોનાં સલાહ સુચન મુજબ તમામ પ્રકારની કામગીરી, પ્રાયમરી હેલ્થ વર્કર તથા બેલદાર પાસે લેવી.</li> <li>➢ રાઇટ ટુ ઇન્ફર્મેશન એકટની અરજીઓના નિકાલની કામગીરી</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૬)	પ્રાયમરી હેલ્થ વર્કર	<ul style="list-style-type: none"> <li>➢ ઇન્દ્રા. સર્વેલન્સ અંગેની કામગીરી તથા એન્ટીલાર્વલ અંગેની કામગીરી, ફોર્ગીંગ અંગેની કામગીરી.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૭)	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ જાહેર જનતા તરફથી આવતી અરજીઓ સ્વીકારી તેની પહોંચ આપવાની કામગીરી એટલે કે ઇનવર્ડ, આઉટવર્ડ એમ બંને પ્રકારની કામગીરી, જે તે ખાતામાંથી આવતા પત્રનો નિકાલ વિગેરે કામગીરી,</li> <li>➢ ઉપરી અધિકારી દ્વારા વખતો વખતો સોંપવામાં આવતી કામગીરી.</li> <li>➢ ટેન્ડર અંગેની કામગીરી,</li> <li>➢ ઇજારાદારના બીલ, રીપોર્ટ અંગેની કામગીરી.</li> <li>➢ એસ્ટા. વિભાગની કામગીરી,</li> <li>➢ રોગચાળાની નોંધણી અંગેની કામગીરી.</li> <li>➢ જન્મ-મરણ- લગ્ન નોંધણીની કામગીરી, રેકર્ડની કામગીરી સીવીક સેન્ટર કેશ કલેક્શન, ટેનામેન્ટનાં સ્થળ પર હૃત્તા વસુલાત,</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૮)	મુકાદમ	<ul style="list-style-type: none"> <li>➢ જીલ્લામાં (વિસ્તારમાં) સફાઈ, છેપીંગ, બ્રસીંગની તેમજ આરોગ્યલક્ષી તમામ કામગીરી</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતાં કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૯)	પટાવાળા	<ul style="list-style-type: none"> <li>➢ ઓફિસને લગતી કામગીરી તેમજ ટપાલ વહેચવાની કામગીરી કરવી.</li> </ul>
<b>મહેકમ વિભાગ</b>		
(૧)	પસોનેલ ઓફિસર	<ul style="list-style-type: none"> <li>➢ સમગ્ર જોનનાં કર્મચારીઓને લાગત વહીવટી અધિકારી તરીકેની કામગીરી.</li> <li>➢ આંતરીક ખાતાકીય તપાસને લગતી તમામ કામગીરી.</li> <li>➢ કર્મચારીઓ નિયમિત હાજર રહે તે જોવાની તથા વખતોવખત હાજરીપત્રક ચેક કરવાની કામગીરી, ફીલ્ડ ડયુટી ઉપર ફીજીકલ હાજરી ચેક કરવાની કામગીરી.</li> <li>➢ મહેકમને લગતી તમામ કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<ul style="list-style-type: none"> <li>➢ નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.</li> <li>➢ આર.ટી.આઈ એકટ અન્યથે જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજો અદા કરવાની કામગીરી.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આઝી વખતે સૌંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૨)	પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ મહેકમ ને લાગત કોર્ટ મેટરની કાર્યવાહી આ ઉપરાંત ખાતાનાં વડા અધિકારી સૌંપે તે કામગીરી કરવાની રહે છે.</li> <li>➢ રાઇટ ટુ ઇન્ફર્મેશન એકટની અરજીઓના નિકાલની કામગીરી.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આઝી વખતે સૌંપવામાં આવતી વધારાની કામગીરી.</li> <li>➢ ખાતાને લાગત બાબતે અન્ય વિભાગ માટેના પત્રવ્યવહાર / રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી.</li> <li>➢ કર્મચારીઓની ફરજ પરની નિયમિતતા બાબત.</li> <li>➢ તાબા હેઠળનાં કર્મચારીઓ પાસેથી ખાતા સંબંધિત કામગીરી કરવવા બાબત.</li> <li>➢ સેકશનમાં દરેક દફ્તરોને લગતી જવાબદારી તથા અન્ય સુપરવાઈઝિંગ પ્રકારની કામગીરી.</li> <li>➢ મહેકમને લગતી તમામ કામગીરીનું નિરીક્ષણ અને નિયંત્રણ.</li> <li>➢ રાઇટ ટુ ઇન્ફર્મેશન એકટની મહેકમને લાગત અરજીઓના નિકાલની કામગીરી.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આઝી વખતે સૌંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૩)	બીજી શ્રેષ્ઠી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ બીજી શ્રેષ્ઠી કલાર્કની કુલ – ઉંચ એકત્રીસ જગ્યા ખાલી છે.</li> </ul>
(૪)	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ સેન્ટ્રલ ઝોન કક્ષાએ ખાતાકીય તપાસ અંગેની તમામ કાર્યવાહી.</li> <li>➢ કર્મચારી નોકરીમાં નવી નિમણૂંકથી નિવૃત્ત / મરણ થાય ત્યારસુધીની મહેકમની તમામ કામગીરી.</li> <li>➢ પેન્શન તથા આશ્રિતને રહેમરાહે નોકરી આપવા અંગેની કાર્યવાહી.</li> <li>➢ મહેકમને લાગત ઓડિટ ઓફિશનનાં નિકાલની કામગીરી.</li> <li>➢ આકસ્મિક સંજોગોમાં કર્મચારીઓને પગાર (કેસમાં) ચૂકવવાની કામગીરી.</li> <li>➢ આધારકાર્ડની લગતી 18+ ની ઓનલાઈન પોર્ટલ પર આવતી અરજીના વેરીઝિફેશનની કામગીરી.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આઝી વખતે સૌંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૫)	પટાવણા	<ul style="list-style-type: none"> <li>➢ સ્ટેશનરી તથા અન્ય ચીજવસ્તુ લાવવાની કામગીરી .</li> <li>➢ રીપોર્ટ ફાઈલીંગ, સેવાપોથી, પેન્શન ફાઈલો બાંધવાની કામગીરી.</li> <li>➢ ઉપલા અધિકારીશ્રી દ્વારા સૌંપવામાં આવતી તમામ કામગીરી.</li> </ul>
<b>વહીવટી વિભાગ</b>		
(૧)	સેક્શન ઓફિસર	<ul style="list-style-type: none"> <li>➢ કર્મચારીઓ નિયમિત ફરજ પર હાજર રહે છે કે નહિ તે બાબત.</li> <li>➢ તાબા હેઠળનાં કર્મચારીઓ પાસેથી લેવાની કામગીરી.</li> <li>➢ સેકશનમાં દરેક દફ્તરોને લગતી જવાબદારી તથા અન્ય સુપરવાઈઝિંગ પ્રકારની કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિજન – હાજરી નિયંત્રણ.</li> </ul>
(૨)	હેડ કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ નાગરિક અધિકાર પત્રકના રીપોર્ટની ચકાસણીની કામગીરી.</li> <li>➢ પી.ઓ.શ્રી ના આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.</li> <li>➢ આર.ટી.આઈ. અંતર્ગત માહિતી તૈયાર કરી આપવી.</li> <li>➢ એસ.ઓ.શ્રી ના આદેશ મુજબની કામગીરી.</li> <li>➢ ખાતાકીય નોંધ કાઢવાની કામગીરી.</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<ul style="list-style-type: none"> <li>➢ સી.ક્ર્યુ. ના જવાબો.</li> <li>➢ આર.ટી.આઈ. વિભાગ, ડીસ્પેચ વિભાગ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કોમ્પ્યુટર વિભાગ, વાયરલેસ ઓફિસ, મુલાકાતી એન્ટ્રી ગેટપાસ, આધારકાર્ડ વિભાગ તેમજ વહીવટી વિભાગમાં અન્ય તમામ પ્રકારની વ્યવસ્થાપનની કામગીરી જેમકે, ૨જા પર રહેતાં કર્મચારીઓની જગ્યા પર અન્ય કર્મચારીનો બંદોબસ્ત ગોઠવવો તથા ઝોન ખાતેના ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રોનિક્સ સાધનો બગડયા હોય ત્યારે રીપેરીંગ બાબતે રૂબરૂ જઈ અથવા રીપોર્ટ કરી વ્યવસ્થા કરવાની કામગીરી.</li> <li>➢ કાર્યપાલક ઈજનેરશ્રીઓ ધ્વારા મળતી મૌખિક સુચના મુજબ કરવાની થતી કેટલીક તાકીદની કામગીરી.</li> <li>➢ કોમ્પ્યુનિટી હોલનાં રીફડબીલ/મંજુરી ઉપર સહી.</li> <li>➢ ડીપોઝીટ અભિપ્રાયના લેખપત્રો ઉપર સહી.</li> </ul>
(3)	ત્રીજી શ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ નાગરિક અધિકાર પત્રક ના રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી.</li> <li>➢ હાજરીના ડેટા તૈયાર કરી દર ૧૦ દિવસે ઈ.સી.ને મોકલવાની કામગીરી.</li> <li>➢ સી.એલ. કાર્ડ મેઈન્ટેઇન કરવાની કામગીરી.</li> <li>➢ હેડકલાર્કના આદેશ મુજબની કામગીરી.</li> <li>➢ પી.ઓ.શ્રીના આદેશ મુજબની કામગીરી.</li> <li>➢ વહીવટી અહેવાલ તૈયાર કરવાની કામગીરી.</li> <li>➢ પ્રો-એક્ટિવ ડીસ્કલોઝર તૈયાર કરવાની કામગીરી.</li> <li>➢ આધારકાર્ડની લગતી 18+ ની ઓનલાઈન પોર્ટલ પર આવતી અરજીના નિકાલની કામગીરી.</li> <li>➢ વળતર ૨જાનું ૨જીસ્ટર નિભાવવું.</li> <li>➢ ઠરાવ ૨જીસ્ટર નિભાવવું.</li> <li>➢ ઝેરોશ કોપીઓનું ૨જીસ્ટર નિભાવવું.</li> </ul>
(4)	પટાવાળા	<ul style="list-style-type: none"> <li>➢ સ્ટેશનરી તથા અન્ય ચીજવસ્તુ લાવવાની કામગીરી .</li> <li>➢ રીપોર્ટ ફાઈલીંગ, સેવાપોથી, પેન્શન ફાઈલો બાંધવાની કામગીરી.</li> <li>➢ ઉપલા અધિકારીશ્રી દ્વારા સોંપવમાં આવતી તમામ કામગીરી.</li> </ul>
<b>હિસાબી વિભાગ</b>		
		<p>સુરત મહાનગરપાલિકામાં સેન્ટ્રલઝોન હિસાબી ખાતામાં ૦૧ (એક) પ્રથમ શ્રેણી કલાર્ક, ૦૧ (એક) બીજી શ્રેણી કલાર્ક, ૦૪ (ચાર) ત્રીજી શ્રેણી કલાર્ક અને ૦૧ (એક) કોમ્પ્યુટર ઓપરેટર તથા ૦૧ (એક) પટાવાળા ફરજ બજાવી રહ્યા છે. એકાઉન્ટ ખાતાની કામગીરીમાં સેન્ટ્રલ ઝોનનાં તમામ ખાતાઓનાં બીલો સ્વીકારી બીલ ચેક કરી તેમજ ઈ-એકાઉન્ટીંગ સોફ્ટવેરમાં બનાવી મુખ્ય હિસાબી ખાતામાં મોકલી આપવામાં આવે છે. જનરલ એડવાન્સની તથા ઓડિટ ખાતા ધ્વારા કાઢવામાં આવેલ ઓડિટ વાંધા અને પ્રાથમિક ઓડિટ વાંધા જે તે ખાતામાં મોકલાવી તેનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝોનનાં બજેટની કામગીરી એકાઉન્ટ ખાતા ધ્વારા કરવામાં આવે છે.</p>
(1)	ડેપ્યુટી એકાઉન્ટન્ટ	<ul style="list-style-type: none"> <li>➢ હિસાબી વિભાગને લગતી તમામ કામગીરી.</li> <li>➢ બજેટ, જનરલ એડવાન્સ, ડીપોઝીટ, આવક-ખર્ચને લગતી તમામ કામગીરી.</li> <li>➢ ઓડિટ ઓફ્જેક્શનના સંકલનની કામગીરી.</li> <li>➢ રીકુપમેન્ટની કામગીરી.</li> <li>➢ ઇન્ક્રીમેન્ટનાં અભિપ્રાયની કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચેના કર્મચારીઓની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.</li> <li>➢ આરટીઆઈ એક્ટ અન્વયે જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજો અદા કરવાના કામો.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફિસ વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(2)	પ્રથમ શ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ ઓડિટ ઓફ્જેક્શનના નિકાલ કરવાની કામગીરી.</li> <li>➢ જનરલ એડવાન્સ, રીકુપમેન્ટની કામગીરી.</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<ul style="list-style-type: none"> <li>➢ સ્ટોર ડિપોઝિટ એકાઉન્ટ રીકુપમેન્ટની કામગીરી.</li> <li>➢ વેપારી બીલ, રનીગ બીલ, ફાઈનલ બીલ તેમજ હિસાબી વિભાગને લગતી તમામ કામગીરી.</li> <li>➢ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીની કામગીરી / હાજરી / વર્તણૂક બાબતે અસરકારક સુપરવિઝનની કામગીરી તથા હાજરી નિયંત્રણ.</li> <li>➢ ડેપ્યુટી એકાઉન્ટનું ધ્વારા સૌંપવામાં આવતી તમામ કામગીરી.</li> <li>➢ બેક રીકન્સીલેશનની કામગીરી.</li> <li>➢ હિસાબી વિભાગમાં આવતા તમામ પ્રકારનાં બીલો ચકાસણી કરવાની કામગીરી.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આશ્ચર્ય વખતે સૌંપવામાં આવતી વધારાની કામગીરી.</li> <li>➢ આ ઉપરાંત ખાતાનાં વડા અધિકારી સૌંપે તે કામગીરી કરવાની રહે છે.</li> </ul>
(૩)	બીજી શ્રેષ્ઠી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ હિસાબી વિભાગમાં આવતા તમામ પ્રકારનાં બીલો ચેક કરવાની કામગીરી. તમામ ૨જીસ્ટર મેઇન્ટેઇન કરવાની કામગીરી.</li> <li>➢ મુખ્ય હિસાબી ખાતા સાથે સંકલન કરવાની કામગીરી.</li> <li>➢ બજેટને લગતી તમામ કામગીરી.</li> <li>➢ અન્ય પ્રકારની ખાતા તરફથી સૌંપવામાં આવતી કામગીરી.</li> </ul>
(૪)	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ બીલ બનાવવાની કામગીરી.</li> <li>➢ તમામ ૨જીસ્ટર મેઇન્ટેઇન કરવાની કામગીરી.</li> <li>➢ મુખ્ય હિસાબી ખાતા સાથે સંકલન કરવાની કામગીરી.</li> <li>➢ બજેટને લગતી તમામ કામગીરી.</li> <li>➢ અન્ય પ્રકારની ખાતા તરફથી સૌંપવામાં આવતી કામગીરી.</li> <li>➢ બેક રીકન્સીલેશનની કામગીરી.</li> <li>➢ જનરલ એડવાન્સ રીકુપમેન્ટ કરવાની કામગીરી.</li> <li>➢ ડિપોઝિટનાં ૨જીસ્ટર નિભાવવા તથા અભિપ્રાય આપવાની કામગીરી.</li> <li>➢ ટેકનિકલ વિભાગ ધ્વારા આપવામાં આવતી ગ્રાંટની માહિતીનાં આધારે વાઉચરની ચકાસણી કરી U.C.આપવાની કામગીરી.</li> <li>➢ વિવિધ સેન્ટરો પરથી ભરણું કલેક્ટ કરવાની કામગીરી.</li> <li>➢ સેન્ટ્રલ ઝોનની હદમાં આવતા તમામ વોર્ડ ઓફિસ, માર્કેટ, હેલ્થ સેન્ટર, હોસ્પિટલ, સ્વીમીંગ પુલ, ફાયર સ્ટેશન વગેરેનાં ભરણું સ્વીકારવાની કામગીરી.</li> <li>➢ આવકનું રીકન્સીલેશન કરવાની કામગીરી.</li> <li>➢ જનરલ ભરણાંના રીટન ચેકના રીજીસ્ટર નિભાવી વાઉચર બનાવવાની કામગીરી.</li> <li>➢ પર્સનલ એડવાન્સની કામગીરી.</li> <li>➢ સિવિક સેન્ટરમાં આવતા તમામ ભરણાં સ્વીકારવાની કામગીરી.</li> <li>➢ ટે-બુક નિભાવવાની કામગીરી.</li> <li>➢ વોર્ડ કમિટીની કામગીરી</li> </ul>
<b>આકારણી અને વસુલાત વિભાગ</b>		
(૧)	આકારણી અને વસુલાત અધિકારી	<ul style="list-style-type: none"> <li>➢ સુરત મહાનગરપાલિકાનાં વિસ્તારમાં આવેલ મિલકતોની આકારણી દફતરે વેરાનાં હેતુ માટે એસેસમેન્ટ કરી ખાસ નોટીસ બજાવવી તથા નોંધણી કરાવવી.</li> <li>➢ આવી મિલકતો માટેનું એસેસમેન્ટ ૨જીસ્ટર, કટબુક ૨જીસ્ટર તથા તેને આનુસાંધિક અન્ય રેકર્ડની જાળવણી કરાવવી.</li> <li>➢ મિલકતોની આકારણી થયા બાદ તેના યોગ્ય તે સમયે વેરા માટેનાં બીલો તૈયાર કરવા તથા તે મ્યુનિસીપલ વેરાની રીકવરી કરાવી/કરાવવી.</li> <li>➢ ધી. બી. પી. એમ. સી. એક્ટ મુજબ જો વેરાની વસુલાત ન થાય તો નક્કી કરેલ સમય મર્યાદામાં નોટીસ, વોરંટ બજાવી ત્યાર બાદ, યોગ્ય તે સમયે તેવી મિલકતોને જપ્તીમાં લઈ વેરા વસુલાતની આગળની કાર્યવાહી કરવી.</li> <li>➢ દર એપ્રિલ માસમાં તમામ મિલકતોની થયેલ આકારણીનું ૨જીસ્ટર જાહેર જનતા માટે ખુલ્ખું મુકવું અને તેમાં આવેલ વાંધાઓ એપેક્સેટ</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<ul style="list-style-type: none"> <li>➤ ઓફિસર ધવારા સંભળાવવાની વ્યવસ્થા કરવી.</li> <li>➤ થયેલ એપેલેટનાં હુકમનો અમલ કરવો. તેની ખાસ નોટીસ બજાવવી.</li> <li>➤ વખતોવખત મિલકતોનાં માલિકો, ધારણકર્તાઓ, કબજેદારનાં નામ રજુ કરેલ દસ્તાવેજી પુરાવાઓને આવિન આકારણી દફતરે ફેરફાર કરવા.</li> <li>➤ અરજદાર તરફથી આવતી નવી મિલકત માટેની આકારણી કરવાનાં હેતુ સારુ આવતી અરજીઓ સ્વકારી તેવી નવી / ફેરફાર થયેલ મિલકતોની આકારણી કરી આકારણી દફતરે ચઢવી તેની રીવાઈઝ નોટીસ આપી બીલ ઈસ્યુ કરવા.</li> <li>➤ આરટીઆઈ એક્ટ અન્યે જાહેર માહિતી અધિકારી તરીકેની કામગીરી.</li> <li>➤ પુર કે અન્ય કુદરતી આફત વખતે સૌંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૨)	સેક્શન ઓફિસર	<ul style="list-style-type: none"> <li>➤ કર્મચારીઓ નિયમીત ફરજ પર હાજર રહે છે કે નહિ તે બાબત.</li> <li>➤ તાબા હેઠળનાં કર્મચારીઓ પાસેથી લેવાની કામગીરી,</li> <li>➤ ગર્વમેન્ટ તરફથી માંગ્યા મુજબની માહિતી નિયમીત જાય છે કે નહિ તે જોવું,</li> <li>➤ સેક્શનમાં દરેક દફતરોને લગતી જવાબદારી તથા અન્ય સુપરવાઈઝીંગ પ્રકારની કામગીરી,</li> <li>➤ મહેકમને લગતી તમામ કામગીરી,</li> <li>➤ ઝોનનાં વહીવટને લગતી કામગીરી.</li> <li>➤ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલ તથા મદદનીશ જા.મા.અધિ.ની કામગીરી</li> <li>➤ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન – હાજરી નિયંત્રણ.</li> <li>➤ આકારણી વિભાગમાં સર્વેયર ધવારા મુકવામાં આવતા તુમારની ચકાસણી / વેરા વસુલાતને લગતી કામગીરી.</li> <li>➤ પુર કે અન્ય કુદરતી આફત વખતે સૌંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૩)	પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➤ ઓડિટ ઓફિશનનો નિકાલ કરવાની કામગીરી,</li> <li>➤ જનરલ એડવાન્સ, રીકુપમેન્ટની કામગીરી,</li> <li>➤ સ્ટોર ડિપોઝીટ એકાઉન્ટ રીકુપમેન્ટની કામગીરી,</li> <li>➤ આ કામગીરી જે તે ખાતાવાર અલગ અલગ પ્રકારની આ ઉપરાંત ખાતાનાં વડા અધિકારી સૌંપે તે કામગીરી કરવાની રહે છે.</li> <li>➤ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલની તમામ કામગીરી માટે લાગત મ.જા. મા.અધિ. પાસેથી માહિતી મેળવવાની કામગીરી.</li> <li>➤ વેરાવસુલાતની સુપરવિઝનની કામગીરી, આકારણીના તુમારોનું ચેકીંગની કામગીરી.</li> <li>➤ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીની કામગીરી / હાજરી / વર્તણૂક બાબતે અસરકારક સુપરવિઝનની કામગીરી તથા હાજરી નિયંત્રણ</li> <li>➤ પુર કે અન્ય કુદરતી આફત વખતે સૌંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૪)	બીજી શ્રેષ્ઠી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➤ વોર્ડ વિસ્તારની મિલકતની સ્થળતપાસની કામગીરી</li> <li>➤ સર્વેયરની કામગીરી, તુમાર તૈયાર કરવા</li> <li>➤ મિલકતની આકારણી કરી તુમાર તૌયાર કરવા તથા મિલકત વેરાની વસુલાતની કામગીરી</li> <li>➤ ડેઝુક, રીટર્ન ચેક, શિક્ષણ ઉપકર,</li> <li>➤ બીલો, વોરટ, નોટિસ, ખાસ નોટિસ બજાવવાની કામગીરી.</li> <li>➤ રેકર્ડની કામગીરી પર દેખરેખ રાખવી, રેકર્ડ એ, બી, સી, ડી, વાઈઝ રેકર્ડ ગોઠવવો.</li> <li>➤ પ્રથમ શ્રેષ્ઠી કલાર્કની ગેરહાજરીમાં તેમને સૌંપવામાં આવેલ કામગીરી.</li> <li>➤ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલ માટે સમયસર માહિતી પુરી પાડવાની કામગીરી</li> <li>➤ પુર કે અન્ય કુદરતી આફત વખતે સૌંપવામાં આવતી વધારાની</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
(૫)	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	<p>કામગીરી.</p> <ul style="list-style-type: none"> <li>➢ વોર્ડ વિસ્તારની મિલકતની સ્થળતપાસની કામગીરી</li> <li>➢ વોર્ડ ઈન્સ્પેક્ટરની કામગીરી, તુમાર તૈયાર કરવા</li> <li>➢ વેરા કે અન્ય રીકવરીના નાણાંની રસીદ આપી, વસુલાત કરી સદર નાણાં તિજોરીમાં જમા કરાવવાની કામગીરી</li> <li>➢ જાહેર જનતા તરફથી આવતી અરજીઓ સ્વીકારી તેની પહોંચ આપવાની કામગીરી એટલે કે ઈનવર્ડ, આઉટવર્ડ એમ બંને પ્રકારની કામગીરી, જે તે ખાતામાંથી આવતા પત્રનો નિકાલ વિગેરે કામગીરી.</li> <li>➢ ફિલ્ડબુક કલાર્કની તેમજ વોર્ડ ઈન્સ્પેક્ટરની કામગીરી.</li> <li>➢ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલની કામગીરી.</li> <li>➢ પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>
(૬)	પટાવાળા	<ul style="list-style-type: none"> <li>➢ ખાતાની ટપાલ વિવિધ ડીપાર્ટમેન્ટમાં આપવી. સ્થાનિક ટપાલની વિતરણની કામગીરી. મિલકતવેરાના કરદાતાઓ ધ્વારા થતી ફરીયાદની ફાઈલનો રેકર્ડ વ્યવસ્થિત રાખવો.</li> </ul>

### નાગરિક સુવિધા કેન્દ્ર

સુરત મહાનગરપાલિકાની જુદી જુદી સેવાઓ અને ફરિયાદોના નિવારણની સગવડ પૂરી પાડવાના હેતુથી નાગરિક સુવિધા કેન્દ્રની શરૂઆત ૨૦૦૩ થી કરવામાં આવી છે. આ સેન્ટર ખાતે કોમ્પ્યુટર નેટવર્ક દ્વારા નાગરિક સેવાઓ જેવી કે જન્મ-મરણ નોંધણી, વેરા સ્વીકાર વિગેરે સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હાલમાં સેન્ટ્રલ ઝોન નાગરિક સુવિધા કેન્દ્રમાં ૧-એક્ઝિઝ.આસીસ્ટન્ટ, ૧-પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક (હેડ કેશિયર), ૦૮-ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક, ૦૮-કરારીય કોમ્પ્યુટર ઓપરેટર, ૩-પટાવાળા અને ૧-બેલદાર તથા મિલેનિયમ માર્કેટ નાગરિક સુવિધા કેન્દ્રમાં ૩-ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક, ૨-પટાવાળા, ૧-બેલદાર ફરજ બજાવે છે. નાગરિક સુવિધા કેન્દ્રમાં કામગીરી આ પ્રમાણે છે.

- જન્મ-મરણ પ્રમાણપત્ર
- કલેક્શન : મિલકતવેરો, શિક્ષણ ઉપકર, વિવિધ ચાર્જીસ, ડીપોઝીટ, પરચુરણ આવક, પેનલ્ટી વ્યાજ વિગેરે
- મિલકત વેરાની સ્વાચારણી, વિવિધ ફરિયાદોની નોંધણી, ઈ-મેઇલ/ડીજીટલ મીડીયા ધ્વારા આવતી ફરિયાદો
- મહાનગરપાલિકાના હોલ, ઓપન પ્લોટનું બુકીંગ
- મ્યુનિસિપલ ટેનામેન્ટ, ઈ.ડબલ્યુ.એસ.મકાનના હપ્તા તથા શોપીંગ કોમ્પ્લેક્શનનું ભાડુ
- ટી.પી.પાર્ટ પ્લાનની કોપી
- તમામ પ્રકારની અરજીઓનું સ્વીકાર કેન્દ્ર
- તમામ પ્રકારના ફોર્મ તથા મહાનગરપાલિકાની પ્રકાશિત પુસ્તકાઓનું વેચાણ
- વેબસાઈટ ધ્વારા પ્રાપ્ત માહિતીઓની ઓનલાઈન સુવિધા [www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in) ઉપરથી નીચેની સુવિધા મળી શકશે.
  - વિવિધ ફોર્મનું ડાઉન લોડીંગ
  - કમ્પ્લેઇન નોંધણી
  - ટેન્ડર નોટિસની માહિતી, વિવિધ કમિટીઓના એજન્ડા તથા મહાનગરપાલિકાની અન્ય જાહેરાતો
  - મહાનગરપાલિકાની રોજગારલક્ષી માહિતી
  - જાહેર માહિતી અધિકારની અરજીઓ સ્વીકારી તેમજ તે અંગેની ફી વસુલ કરવાની કામગીરી
- રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલની કામગીરી.
- પુર કે અન્ય કુદરતી આફત વખતે સોંપવામાં આવતી વધારાની કામગીરી.

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
(૧)	એક્ઝિઝ.આસીસ્ટન્ટ અને આસીસ્ટન્ટ કમિશનર શ્રી સાઉથ ઝોન - બી	<ul style="list-style-type: none"> <li>➢ નાગરિક સુવિધા કેન્દ્રની તમામ કામગીરીઓ વ્યવસ્થિત રીતે ચાલે તે માટે તેનું સફળતાપૂર્વક સંચાલન કરવાની કામગીરી.</li> <li>➢ આર.ટી.આઈ.ની અરજીઓની લાગત સત્તામંડળમાં તબદીલ કરવાની કામગીરી.</li> <li>➢ સુરત મહાનગરપાલિકામાં આવનાર ઈન્ટરનેશનલ અને નેશનલ લેવલના ડેવીગેશન માટે નોડલ ઓફિસર તરીકેની કામગીરી.</li> <li>➢ સાઉથઝોન-બી (કનકપુર)ના વહીવટી વિભાગના વડા તરીકે ફરજ બજાવવી, જેમાં સાઉથઝોન-બી (કનકપુર) ઝોનના ઈજનેરી વિભાગ સિવાયના તમામ વિભાગો જેવા કે, આકારણી અને વેરા વસુલાત વિભાગ, ગુમાસ્તાધારા અને વ્યવસાયવેરા વિભાગ, મહેકમ વિભાગ, હિસાબી વિભાગ, પ્રોફેશનલ કાયદા / લિગલ વિભાગની તમામ કામગીરી ઉપર દેખરેખ રાખવી અને તાબા હેઠળના સ્ટાફ મારફત કામગીરી કરાવવી.</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<p>જમીન–મિલ્કટ વિભાગની નાણાંકીય વસુલાત સંબંધીત કામગીરી.</p> <p>➤ આર.ટી.આઈ.એક્ટ – ૨૦૦૫ હેઠળ ઉપરોક્ત વિભાગો પરત્વેના અપીલ અધિકારી તરીકેની સત્તા પ્રદાન કરવામાં આવેલ છે. તેઓના કાર્યક્ષેત્ર હેઠળના વિભાગોના અપીલ અધિકારી તરીકેની કામગીરી.</p> <p>➤ પુર, મહામારી, ભુંપ, વાવાડોડા કે અન્ય કુદરતી આફિતો વખતે કમિ.શ્રી ધ્વારા સોંપવામાં આવતી વધારાની કામગીરી</p>
(૨)	પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક	<p>➤ હેડ કેશિયર તરીકેની કામગીરી.</p> <p>➤ નાગરિક સુવિધા કેન્દ્રની વિવિધ કામગીરીઓ પર દેખરેખ રાખવાની કામગીરી.</p> <p>➤ ભરણાંની કામગીરી.</p>
(૩)	બીજી શ્રેષ્ઠી કલાર્ક	➤ જગ્યા ખાલી છે.
(૪)	તાલીમાર્થી / ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	<p>➤ નાગરિક સુવિધા કેન્દ્રમાં પુરી પાડવામાં આવતી સેવાઓના કાઉન્ટર સંભાળવાની કામગીરી.</p> <p>➤ તમામ પ્રકારના ચેકની ગોઠવણીની કામગીરી તથા ભરણું જમા કરવાની કામગીરી.</p>
(૫)	પટાવણા / બેલદાર	<p>➤ સ્ટેશનરી તથા અન્ય ચીજવસ્તુ લાવવાની કામગીરી.</p> <p>➤ રીપોર્ટ ફાઇલીગ અંગેની કામગીરી.</p> <p>➤ તમામ પ્રકારની ટપાલ વહેંચણીની કામગીરી.</p> <p>➤ ઓફિસમાં સાફ સફાઈ અંગેની કામગીરી.</p>

### એપેલેટ વિભાગ

સુરત મહાનગરપાલિકામાં સેન્ટ્રલ ઝોન કાયદા ખાતાની જરૂરિયાતનો વિચાર કરી ખાતાની શરૂઆત લગભગ ૧૯૮૫ થી કરવામાં આવી છે. શરૂઆતના વર્ષમાં કાયદા ખાતામાં એક આસી.કાયદા અધિકારી, બીજી શ્રેષ્ઠી કલાર્ક તથા એક પટાવણાની નિમણુંક કરવામાં આવી હતી. હાલમાં સેન્ટ્રલ ઝોન કાયદા ખાતામાં ૧ (આસી.લો ઓફિસર), ૧-બીજી શ્રેષ્ઠી કલાર્ક (હાલમાં એપેલેટ તથા જમીન–મિલ્કટની કામગીરી), ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક તથા ૧-ચોથા વર્ગના કર્મચારી ફરજ બજાવે છે. સેન્ટ્રલ ઝોન કાયદા ખાતાની મુખ્યત્વે કામગીરીમાં સેન્ટ્રલ ઝોનનાં જુદા જુદા ખાતાઓના કાયદાને સ્પર્શતા પ્રશ્નોના અભિપ્રાય આપવા, વકીલોના બીલોના ફી અંગે અભિપ્રાય આપવા, સેન્ટ્રલ ઝોનનાં કેસોનું રજીસ્ટ્રેશન જાળવું, કાયદાકીય બાબતો અંગે સેન્ટ્રલ ઝોન સાથે સંકલન કરી માહિતી આપવી, તેમજ હરકત અરજીની સુનાવણી કરી તેનો નિકાલ કરવો વિગેરે સેન્ટ્રલ ઝોન કાયદા ખાતા દ્વારા કામગીરી કરવામાં આવે છે.

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
(૧)	આસી.લો.ઓફિસર	<p>➤ સેન્ટ્રલ ઝોનના વિવિધ ખાતા ધ્વારા માંગવામાં આવતાં કાનૂની અભિપ્રાય આપવાની કામગીરી.</p> <p>➤ એડવોકેટશ્રીનાં વકીલ ફી નાં બીલના વ્યાજબીપણાના અભિપ્રાયની કામગીરી.</p> <p>➤ કાયદા વિભાગના જાહેર માહિતી અધિકારી તરીકેની કામગીરી.</p> <p>➤ ડિસ્ટ્રીક્ટ કોર્ટકેસ, લેબર કોર્ટ કેસો, સીવીલ કેસોનું મોનીટરીંગની કામગીરી.</p> <p>➤ એપેલેટ ઓફિસર તરીકે ખાસ નોટીસની સામે સમય મયાર્દામાં આવતી વાંધા અરજીઓની રૂબરૂ સુનાવણી કરી જરૂર જણાયે સ્થળ તપાસ કરી નિકાલ કરવાની કામગીરી કરવી.</p> <p>➤ BLC ઘટક અંગેની કાર્યવાહી</p> <p>➤ આસી.કમિશનરશ્રી સેન્ટ્રલ ઝોન દ્વારા સોંપવામાં આવે તે તમામ કામગીરી.</p>
(૨)	બીજી શ્રેષ્ઠી કલાર્ક (હાલમાં એપેલેટ તથા જમીન – મિલ્કટની કામગીરી)	<p>➤ હરકત અરજીનાં રીપોર્ટ રજૂ કરવા તથા સ્થળ તપાસની કામગીરી.</p> <p>➤ આર.ટી.આઈ અરજીની વિગતો બેંગી કરવાની કામગીરી.</p> <p>➤ આસી.લો ઓફિસરશ્રી દ્વારા સોંપવામાં આવે તે તમામ કામગીરી</p>
(૩)	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	<p>➤ ઈન્વર્ડ / આઉટવર્ડની કામગીરી, ટાઈફિંગની કામગીરી.</p> <p>➤ આર.ટી.આઈ રજીસ્ટર મેઇન્ટેન કરવું તથા ઓન લાઈન અરજીઓનો નિકાલ કરવાની કામગીરી કરવી.</p> <p>➤ ઓન લાઈન તમામ કોર્ટ કેસ મોનીટરીંગ તથા અપેટ કરવાની અને જે તે સમયે તેમજ દર માસ દરમ્યાન તમામ વિભાગના કોર્ટ કેસની માંગેલ માહિતી તૈયાર કરવાની કામગીરી</p> <p>➤ આસી.લો ઓફિસરશ્રી દ્વારા સોંપવામાં આવે તે તમામ કામગીરી.</p>
(૪)	પટાવણા –૧	<p>➤ સ્ટેશનરી તથા અન્ય ચીજવસ્તુ લાવવાની કામગીરી.</p> <p>➤ રીપોર્ટ ફાઇલીગ અંગેની કામગીરી.</p>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<ul style="list-style-type: none"> <li>➢ ઓફિસમાં સાફ્ટ-સફાઈ અંગોની કામગીરી.</li> <li>➢ આસી.લો ઓફિસરશ્રી ધવારા સૌંપવામાં આવે તે કામગીરી.</li> </ul>
<b>જન્મ મરણ અને લગ્ન નોંધણી વિભાગ</b>		
		<p>સુરત મહાનગરપાલિકામાં સેન્ટ્રલ ઝોન જન્મ-મરણ વિભાગની શરૂઆત ૧૯૮૮ થી કરવામાં આવી છે. જાન્યુઆરી-૨૦૦૮ થી લગ્ન નોંધણીની કામગીરી સુરત મહાનગરપાલિકાને સૌંપવામાં આવતા સેન્ટ્રલ ઝોન જન્મ-મરણ વિભાગમાં લગ્ન નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવી. હાલમાં સેન્ટ્રલ ઝોન જન્મ-મરણ નોંધણી વિભાગમાં ૨-સ્ટે.આસી., ૨-ત્રીજી શ્રેણી કલાર્ક, ૨-ડેટા એન્ટ્રી ઓપરેટર, ૨-પટાવાળા ફરજ બજાવે છે.</p> <p>સેન્ટ્રલ ઝોન જન્મ-મરણ અને લગ્ન નોંધણી વિભાગની મુખ્યત્વે કામગીરીમાં જન્મ-મરણ અને લગ્નનાં બનાવોની નોંધ કરી તેના પ્રમાણપત્ર બનાવી અરજદારને આપવા. અપાયેલ જન્મ-મરણ કે લગ્નનાં પ્રમાણપત્રમાં અરજદાર દ્વારા જો કોઈ નોમીનલ ભૂલ થઈ હોય તો તે સુધારા/વધારાની અરજી સ્વીકારી સુધારાની કામગીરી કરવામાં આવે છે. સાને ૨૦૧૭ થી સંસ્થામાં (હોસ્પિટલમાં) થતા જન્મ કે મરણના બનાવોની નોંધ ઓનલાઈન કરવામાં આવેલ છે. ૦૧/૦૪/૨૦૨૦ થી જન્મ કે મરણના બનાવોની નોંધ ગુજરાત ગવર્નર્ના ઈ-ઓળખના સોફ્ટવેરમાં ઓનલાઈન કરવામાં આવેલ છે અને તે મુજબ જન્મ કે મરણના પ્રમાણપત્રો ઈસ્યુ કરવામાં આવે છે.</p>
(૧)	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
૧	સ્ટે.આસી.	<ul style="list-style-type: none"> <li>➢ જન્મ-મરણ અને લગ્ન નોંધણી વિભાગમાં આવતી સુધારા વધારા અરજીઓનો ચકાસણી કરી યોગ્ય નિકાલ કરવો.</li> <li>➢ જન્મ-મરણ અને લગ્ન નોંધણી વિભાગમાં જન્મ અને મરણના પ્રમાણપત્રો મેળવવા માટે આવતી અરજીઓનો સ્ટાફ પાસે નિકાલ કરાવવો.</li> <li>➢ ખાતામાં જરૂરી ચીજ વસ્તુઓના સ્ટોકનું સુપરવીઝન, સ્ટાફનું સુપરવીઝન તેમજ સ્થાનીક કક્ષાએ / રાજ્ય સરકાર સાથે પત્ર વ્યવહાર તથા રીપોર્ટની કામગીરી. ઓફિસની વહીવટી કામગીરી જેવી કે ઈનવર્ડ, આઉટવર્ડ, બીલ વિગેરેની કામગીરી ઉપર દેખરેખ રાખવી.</li> <li>➢ કોર્ટ કેસોની કામગીરી સંભાળવી, ખરાઈની અરજીઓ તથા અરજદાર દ્વારા કરવામાં આવતા પત્રવ્યવહારનાં જવાબ તૈયાર કરવા.</li> <li>➢ જન્મ મરણ તથા લગ્નની જુદી જુદી આંકડાકીય માહિતી તૈયાર કરવી.</li> <li>➢ ઓનલાઈન એન્ટ્રીમાં થતી ભૂલો બાબતે હોસ્પિટલને નોટીસ પાઠવી જવાબ મેળવવા તથા હોસ્પિટલોની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની ચોકસાઈ બાબતે ધ્યાન રખાવવું.</li> <li>➢ ઘરે થતા જન્મ બાબતે સ્થળ તપાસ કરાવવા તથા જે તે હેલ્પ સેન્ટર મારફત ચકાસણી કરાવવા બાબતે પત્ર વ્યવહાર કરવા.</li> <li>➢ જન્મ મરણ અને લગ્નનો રેકર્ડ વર્ષ વાઈજ વ્યવસ્થિત જાળવણી કરાવવી.</li> <li>➢ ઉપરી અધિકારી તરફથી મળતી સુચના મુજબની કામગીરી કરવી.</li> <li>➢ આર.ટી.આઈ.ને લગતી અરજી બાબતે માહિતી આપવી તથા જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી બજાવે છે.</li> </ul>
૨	સ્ટે.આસી.	<ul style="list-style-type: none"> <li>➢ જન્મ-મરણ અને લગ્ન નોંધણી વિભાગમાં આવતી સુધારા વધારા અરજીઓનો ચકાસણી કરી યોગ્ય નિકાલ કરવો.</li> <li>➢ લગ્ન નોંધણીનાં પાર્ટી કોન્ટેક્ટ કરી મંદિરમાં કરવામાં આવતા લગ્નનાં બનાવોમાં નિવેદન લઈ પક્ષકારોની રૂબરૂમાં સહી કરાવવી.</li> <li>➢ કોર્ટ કેસોની કામગીરી સંભાળવી, ખરાઈની અરજીઓ તથા અરજદાર દ્વારા કરવામાં આવતા પત્રવ્યવહારનાં જવાબ તૈયાર કરવા.</li> <li>➢ ઓનલાઈન એન્ટ્રીમાં થતી ભૂલો બાબતે હોસ્પિટલને નોટીસ પાઠવી જવાબ મેળવવા તથા હોસ્પિટલોની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની ચોકસાઈ બાબતે ધ્યાન રખાવવું.</li> <li>➢ ઘરે થતા જન્મ બાબતે સ્થળ તપાસ કરાવવા તથા જે તે હેલ્પ સેન્ટર મારફત ચકાસણી કરાવવા બાબતે પત્ર વ્યવહાર કરવા.</li> <li>➢ જન્મ મરણ તથા લગ્નની જુદી જુદી આંકડાકીય માહિતી તૈયાર કરવી.</li> <li>➢ જન્મ મરણ અને લગ્નનો રેકર્ડ વર્ષ વાઈજ વ્યવસ્થિત જાળવણી કરાવવી.</li> <li>➢ ઉપરી અધિકારી તરફથી મળતી સુચના મુજબની કામગીરી કરવી.</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
૩	ત્રીજી શ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ જન્મ-મરણની સને ૧૯૮૮ થી ૨૦૦૦ સુધીનાં વર્ષોની જન્મ તથા મરણના ગુજરાતી અંગ્રેજી પ્રમાણપત્રોની વધારાની નકલો બનાવવાની તથા આપવાની કામગીરી કરવી.</li> <li>➢ જન્મ-મરણના બનાવોની નોંધણીની કામગીરી કરવી.</li> <li>➢ જન્મ-મરણનાં જુના રેકર્ડને કોમ્પ્યુટરાઈઝ કરવા.</li> <li>➢ ઓનલાઈન એન્ટ્રી માટે હોસ્પિટલ કોડ આપવાની કામગીરી તેમજ તેના સંદર્ભમાં હોસ્પિટલનાં કોન્ટેક્ટમાં રહેવું.</li> <li>➢ ઉપરી અધિકારી તરફથી મળતી સુચના મુજબની કામગીરી કરવી.</li> </ul>
૪	ત્રીજીશ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ પાર્ટી કોન્ટેક્ટ :— લગ્ન નોંધણી અંગે અરજદાર દ્વારા જમા કરાવવા આવતા અરજી ફોર્મ ચેક કરી તેની અરજીઓ સ્વીકારી રીસીદ બનાવવી અને તેનું ભરણ કરવું.</li> <li>➢ બનેલા લગ્નનાં પ્રમાણપત્રો અરજદારને આપવા.</li> <li>➢ લગ્ન નોંધણીની કામગીરી કરવી.</li> <li>➢ લગ્ન નોંધણીનાં પાર્ટી કોન્ટેક્ટ કરી મંદિરમાં કરવામાં આવતા લગ્નનાં બનાવોમાં નિવેદન લઈ પક્ષકારોની રૂખરૂમાં સહી કરાવવી.</li> <li>➢ ઉપરી અધિકારી તરફથી મળતી સુચના મુજબની કામગીરી કરવી.</li> </ul>
૫	કોન્ટ્રાક્ટ બેઇઝ ડેટા એન્ટ્રી ઓપરેટર-૧	<ul style="list-style-type: none"> <li>➢ લગ્ન નોંધણીની કામગીરી કરી લગ્નનું સર્ટી બનાવવું.</li> <li>➢ લગ્નનાં જુના રેકર્ડને કોમ્પ્યુટરાઈઝ કરવો.</li> <li>➢ લગ્નનાં વધારાનાં અંગ્રેજી-ગુજરાતી પ્રમાણપત્રો બનાવવા.</li> <li>➢ ઉપરી અધિકારી તરફથી મળતી સુચના મુજબની કામગીરી કરવી.</li> </ul>
૬	કોન્ટ્રાક્ટ બેઇઝ ડેટા એન્ટ્રી ઓપરેટર-૨	<ul style="list-style-type: none"> <li>➢ શંકાસ્પદ લાગતા લગ્નના કેસમાં સ્થળ તપાસ કરવી.</li> <li>➢ લગ્નનાં રેકર્ડની જાળવણી કરવી.</li> <li>➢ જન્મ- મરણનાં સુધારા વધારા, નોંધણીની તથા જન્મ અને મરણના ગુજરાતી અંગ્રેજી પ્રમાણપત્રોની સને ૧૯૮૮ થી ૨૦૦૦ સુધીની વધારાની નકલો મેળવવાની અરજી ચેક કરી સ્વીકારવી.</li> <li>➢ ઉપરી અધિકારી તરફથી મળતી સુચના મુજબની કામગીરી કરવી.</li> </ul>
૭	પટાવણા-૧	<ul style="list-style-type: none"> <li>➢ લગ્નની અરજીઓ પર જરૂરી સિક્કા મારી લગ્નનું બાઈન્ડર તૈયાર કરવું.</li> <li>➢ લગ્નનો રેકર્ડ જાળવણી કરી પોટલા તૈયાર કરવા.</li> <li>➢ લગ્નના સર્ટીની ઓ.સી.તથા મેમોરેન્ડમની ફાઈલ તૈયાર કરવી.</li> <li>➢ જન્મ-મરણ અને લગ્નનાં બાઈન્ડરો સહીમાં મુકવા જવા કે લેવા જવાની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરી અધિકારી તરફથી મળતી સુચના મુજબની કામગીરી કરવી.</li> </ul>
૮	પટાવણા-૨	<ul style="list-style-type: none"> <li>➢ જન્મ-મરણના સુધારા વધારાની, નોંધણીની એફીડેવીટ કે હુકમનામાની આવતી અરજીઓ આઉટવર્ક-ઈનવર્ડમાં નોંધી બાઈન્ડર તૈયાર કરવા.</li> <li>➢ જન્મ-મરણનાં સને ૧૯૮૮ થી ૨૦૦૦ સુધીની આવતી અરજીઓનાં નિકાલ માટે રજીસ્ટરો શોધી આપવા.</li> <li>➢ જન્મ-મરણ અને લગ્નનાં બાઈન્ડરો સહીમાં મુકવા જવા કે લેવા જવાની કામગીરી કરવી.</li> <li>➢ જન્મ મરણની ઓફીસની સફાઈ કરવી, પાણીની વ્યવસ્થા કરવી.</li> <li>➢ જન્મ મરણનાં રેકર્ડનાં વ્યવસ્થિત પોટલા તૈયાર કરવા.</li> <li>➢ ઉપરી અધિકારી તરફથી મળતી સુચના મુજબની કામગીરી કરવી.</li> </ul>

### ગુમાસ્તાધારા વિભાગ

સુરત મહાનગરપાલિકામાં ગુમાસ્તાધારા વિભાગમાં મંજુર શીડ્યુલ મુજબ ગુમાસ્તાધારા નિરીક્ષક -૬, હેડ કલાર્ક-૧, બીજી શ્રેણી કલાર્ક-૨, ત્રીજી શ્રેણી કલાર્ક-૦૫, પટાવણા-૨ ની નિમણૂંક કરવામાં આવી હતી. હાલમાં ગુમાસ્તાધારા નિરીક્ષક-૬ (૬ પૈકી ૧ ઓનલોન – રાંડેરઝોન), હેડ કલાર્ક-૦, બીજી શ્રેણી કલાર્ક-૧, ત્રીજી શ્રેણી કલાર્ક-૨, પટાવણા-૧ તથા સફાઈ કામદાર – ૧ કર્મચારી ફજર બજાવે છે.

(૧)	ગુમાસ્તાધારા નિરીક્ષક	<ul style="list-style-type: none"> <li>➢ નવા ગુમાસ્તા નોંધણી માટે જરૂરીયાત મુજબના પુરાવો ચેક કરી નવી ગુમાસ્તા નોંધણી કરવી.</li> <li>➢ બંધ થયેલ ગુમાસ્તાધારાની નોંધણીની ચકાસણી કરવાની કામગીરી.</li> <li>➢ સ્થળ તપાસ દરમ્યાન દુકાનધારા કે ગુમાસ્તાધારા બંગ કરેલ હોય તો તે નિરિક્ષણ કરી નોટીસ આપવાની કામગીરી.</li> </ul>
-----	-----------------------	---

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<ul style="list-style-type: none"> <li>➢ દુકાનોમાં કામ કરતા માણસોની હાજરી પત્રક, પગાર પત્રક, ૨જા રીપોર્ટ, વીમો તથા ઓળખકાર્ડ નિભાવે છે કે કેમ? તેની ચકાસણી કરવાની કામગીરી.</li> <li>➢ ગુમાસ્તા નોંધણી પ્રસિધ્ય છે તો તે તપાસ કરી વ્યવસાયવેરો તથા કર્મચારી વેરો તપાસ કરી વસુલ લેવાની કામગીરી.</li> <li>➢ ગુમાસ્તાધારા નિયમનો ભંગ કરેલ હોય તો તે બદલ કોર્ટમાં કેશ મુકવાની કામગીરી.</li> <li>➢ વ્યવસાય વેરો ચાલુ છે કે બંધ અને વસુલાત લેવાની કામગીરી તથા રીટન ચેકની વસુલાતની કામગીરી.</li> </ul>
(૨)	હેડ કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ ગુમાસ્તાધારા રીટન ચેકની નોટીસ કાઢવાની કામગીરી.</li> <li>➢ ગુમાસ્તાધારા રીટન ચેકનું ૨જીસ્ટર તથા બજેટ હેડ મુજબ ૨જીસ્ટર નિભાવણી કરવાની કામગીરી.</li> <li>➢ રીટન ચેકના વહીવટી ચાર્જ વસુલાત કરી ભરણાંની કામગીરી.</li> <li>➢ વિભાગનું હાજરી પત્રક, સી.એલ.કાર્ડ, દર મહિને રીટન ચેકના રીકન્સીલેશન ફાઈલ એકાઉન્ટમાં મોકલવી.</li> <li>➢ વિભાગની બીજી અન્ય વહીવટી કામગીરી.</li> </ul>
(૩)	બીજી શ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ વ્યવસાયવેરાની નવી નોંધણી માટે નમૂના ૧ ઉ ની નોટીસ બજાવવી.</li> <li>➢ વોર્ડના વ્યવસાય વેરાના બીલની વહેંચણી.</li> <li>➢ વોર્ડમાંથી વ્યવસાયવેરો વસુલાત લાવવાની કામગીરી (પાર્ટીના ચેક ભરવાના તથા ભરેલ ચેકની રીસીપ્ટ પાર્ટી સુધી પહોંચાડવા)</li> <li>➢ બીલ ભરવાની છેલ્લી તારીખ વીતી ગયા પછી અંતિમ નોટીસ બજાવવાની.</li> <li>➢ ડિફોલ્ટર મુજબ ધંધાર્થી પાસે વ્યવસાય વેરો વસુલાત લેવાની કામગીરી.</li> <li>➢ કરદાતા વ્યવસાય બંધ કરી ચાલ્યા ગયા હોય તો સ્થળ તપાસ કરી નોટીસ બજાવવાની તથા તેના મૂળ મકાન માલિક પાસેથી સ્ટેટમેન્ટ લેવું.</li> </ul>
(૪)	ત્રીજી શ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ આર.ટી.આઈ.અરજીની માહિતી ભેગી કરવાની કામગીરી તથા ટાઇપીંગ કરી ફાઈલ બનાવવી તથા ૨જીસ્ટર નિભાવવાની કામગીરી.</li> <li>➢ હરકત અરજીનાં રીપોર્ટ રજુ કરવા તથા સ્થળ તપાસની કામગીરી.</li> <li>➢ વ્યવસાયવેરાના નવી નોંધણી, ફેરફાર તથા ૨૬ કરવાની કામગીરી.</li> <li>➢ ઓનલાઈન ગુમાસ્તાને લાગત કામગીરી.</li> <li>➢ ઈનવર્ડ- આઉટવર્ડની કામગીરી.</li> <li>➢ વોર્ડના વ્યવસાય વેરાના બીલની વહેંચણી.</li> <li>➢ વોર્ડમાંથી વ્યવસાયવેરો વસુલાત લાવવાની કામગીરી (પાર્ટીના ચેક ભરવાના તથા ભરેલ ચેકની રીસીપ્ટ પાર્ટી સુધી પહોંચાડવા)</li> <li>➢ બીલ ભરવાની છેલ્લી તારીખ વીતી ગયા પછી અંતિમ નોટીસ બજાવવાની.</li> <li>➢ ડિફોલ્ટર મુજબ ધંધાર્થી પાસે વ્યવસાય વેરો વસુલાત લેવાની કામગીરી.</li> </ul>
(૫)	પટાવણા	<ul style="list-style-type: none"> <li>➢ સ્ટેશનરી તથા અન્ય ચીજ વસ્તુ લાવવાની કામગીરી રીપોર્ટ ફાઈલીંગ અંગેની કામગીરી.</li> <li>➢ સમન્સ તથા નોટીસ આપવા જવાની કામગીરી.</li> <li>➢ ઉપલા અધિકારીશ્રી ધ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી.</li> <li>➢ અન્ય ખાતાઓમાં ટપાલ આપવા તથા લાવવાની કામગીરી.</li> </ul>
<b>જમીન મિલકત વિભાગ</b>		
૧.	જુની.ઈજનેર	<ul style="list-style-type: none"> <li>➢ જમીન મિલકત વિભાગને લગતી તમામ કામગીરી</li> </ul>
૨.	તા.ટેક.આસીસ્ટન્ટ	<ul style="list-style-type: none"> <li>➢ રસ્તા ખોદાણની પરવાનગી આપવા પહેલા વોર્ડ ઓફિસમાંથી અભિપ્રાય મંગાવવો.</li> <li>➢ રસ્તા ખોદાણની પરમીશન આપવાની કામગીરી કરવી.</li> <li>➢ રસ્તા ખોદાણની પરમીશન આપી તેની ડિમાન્ડ નોટ બનાવવી.</li> <li>➢ જે રસ્તા ખોદાણની પરમીશન આપેલ તેની રિકવરીની કામગીરી કરવી.</li> <li>➢ ટોકનથી કરેલ કામના બીલ બનાવવા તથા રિકવરી કરવી.</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<ul style="list-style-type: none"> <li>➢ ટોરેન્ટ પાવર તેમજ ગુજરાત ગેસ કંપની નાં ફાઈનલ મેજરમેન્ટ શીટ મંગાવી ફાઈનલ બીલ બનાવી રિકવરી કરવી.</li> <li>➢ ટોરેન્ટ પાવર કંપની સિવાયની કંપનીઓ ના વાર્ષિક ભાડાબીલ બનાવી રિકવરી કરવી.</li> <li>➢ ROW પર ઓનલાઇન ટોરેન્ટ પાવર તેમજ ગુજરાત ગેસ સિવાયની કંપનીઓને રસના ખોદાણની પરવાનગી આપવાની કામગીરી કરવી.</li> <li>➢ દરેક કંપનીઓની ડિપોઝીટ છુટી કરવાની કામગીરી કરવી.</li> <li>➢ ચુંટણી પંચ ધ્વારા નિયુક્ત કરેલ જે—તે વિધાનસભા મતવિસ્તારમાં નિયત કરેલ ભાગમાં બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) તરીકે સૌંપવામાં આવેલ તમામ કામગીરી કરવી.</li> <li>➢ જોન કક્ષાએથી સમયાંતરે સૌંપવામાં આવતી વિવિધ ઓર્ડરો અંગેની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરી અધિકારીશ્રી ધ્વારા સૌંપવામાં આવતી અન્ય કામગીરી કરવી.</li> </ul>
3.	બીજી શ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૨૧ લોકેશનો પર આવેલ પે એન્ડ પાર્કના ટેન્ડરીનાને લગતી કામગીરી કરવી.</li> <li>➢ પે એન્ડ પાર્કના મંજુર થયેલ કામ અંગે ઈજારદાર પાસે પર્ફોમન્સ ડિપોઝીટ અને સીક્યુરીટી ડિપોઝીટની રકમની વસુલાત કરવી.</li> <li>➢ સદર પે એન્ડ પાર્કના એલોટમેન્ટ લેટર અને વર્કઓર્ડર આપવાની કામગીરી કરવી.</li> <li>➢ દર માસે નિયત લાયસન્સ ફીની વસુલાતની કામગીરી કરવી.</li> <li>➢ દરેક ઈજારદાર સાથે એગ્રીમેન્ટ કરાવવાની કામગીરી કરવી.</li> <li>➢ દરેક પે એન્ડ પાર્કની વિઝિટ કરવી અને ત્યાં જો કોઈ ક્ષતિ માલુમ પડે તો તે અંગેની ઈજારદારને નોટીસ આપવાની કામગીરી કરવી.</li> <li>➢ ઈજારદારને આપવામાં આવેલ નોટીસ અંગે દંડ વસુલાતની કરવાની કામગીરી કરવી.</li> <li>➢ કોર્ટ કેસને લગતાં કેસો અન્વયે ખાતાધિકારી તેમજ આસી.લો ઓફિસર તેમજ સુરત મહાનગરપાલિકાના પેનલ એડવોકેટશ્રીના માર્ગદર્શન / સંકલન અન્વયે કામગીરી કરવી.</li> <li>➢ કોર્ટ કેસના ઠરાવની તારીખે કોર્ટમાં હાજર રહી પેનલ એડવોકેટશ્રીના અને આસી.લો ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળની કામગીરી કરવી.</li> <li>➢ આ ઉપરાંત એપેલેટ વિભાગનો ચાર્જ હોય એપેલેટ વિભાગમાં હરકત અરજીની સ્થળ તપાસ કરી રીપોર્ટ રજૂ કરવાની કામગીરી કરવી.</li> <li>➢ ઉક્ત બંને વિભાગની આર.ટી.આઈ. ને લગતી અરજીના નિકાલની કામગીરી કરવી.</li> <li>➢ આસી.લો ઓફિસરશ્રી ધ્વારા સૌંપવામાં આવે તે તમામ કામગીરી કરવી.</li> <li>➢ જોન કક્ષાએથી સમયાંતરે સૌંપવામાં આવતી વિવિધ ઓર્ડરો અંગેની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરી અધિકારીશ્રી ધ્વારા સૌંપવામાં આવતી અન્ય કામગીરી કરવી.</li> </ul>
4.	બીજી શ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૩૧ લોકેશનો પર આવેલ મ્યુ.શોપીંગ સેન્ટરોની કુલ ઉઘર દુકાનોના સુપરવિઝન તેમજ મોનીટરીંગની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરોક્ત દુકાનોના ભાડાની વસુલાતની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરોક્ત દુકાનો સંબંધિત આવેલ અરજીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરી સદર અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ ઉપરોક્ત દુકાનો સંબંધિત આવેલ આર.ટી.આઈ. એક્ટ હેઠળની અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ ઉપરોક્ત દુકાનો ભાડાપણી રીન્યુઅલની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરોક્ત દુકાનો અન્વયે નામફર અરજી અન્વયે યોગ્ય કાર્યવાહી કરી ભાડુતોના નામ ટ્રાન્સફર કરવા.</li> <li>➢ ઉપરોક્ત દુકાનોને લાગત અન્ય તમામ આનુષ્ઠાનિક કામગીરીઓ કરવી.</li> <li>➢ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૨૨ લોકેશનો પર આવેલ હોકીંગ ઝોનની કુલ ૮૨ લારીઓના સુપરવિઝન તેમજ મોનીટરીંગની કામગીરી કરવી.</li> <li>➢ સદર લારીઓ અંગે આવેલ અરજીઓનો નિકાલ કરવો.</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<ul style="list-style-type: none"> <li>➢ સદર લારીઓના ભાડાની વસુલાત કરવી.</li> <li>➢ સદર લારીઓ અન્વયે નામફેર અરજી અન્વયે યોગ્ય કાર્યવાહી કરી ભાડુતોના નામ ટ્રાન્સફર કરવા.</li> <li>➢ સદર લારીઓ સંબંધિત આવેલ આર.ટી.આઈ. એક્ટ હેઠળની અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ સન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૧ લોકેશનો પર આવેલ વિધવા / વિકલાંગ કેબીનના સુપરવિઝન તેમજ મોનીટરીંગની કામગીરી કરવી.</li> <li>➢ સદર કેબીનો અંગે આવેલ અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ સદર કેબીનોના ભાડાની વસુલાત કરવી.</li> <li>➢ સદર કેબીનો અન્વયે નામફેર અરજી અન્વયે યોગ્ય કાર્યવાહી કરી ભાડુતોના નામ ટ્રાન્સફર કરવા.</li> <li>➢ ઉપરોક્ત કેબીનો સંબંધિત આવેલ આર.ટી.આઈ. એક્ટ હેઠળની અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ સન્ટ્રલ ઝોન વિસ્તારમાં શહેરીજનો ધ્વારા વિવિધ તહેવારો / પ્રસંગો નિમિત્તે બાંધવામાં આવતાં મંડપો અંગે આવતી અરજીઓ અન્વયે યોગ્ય કાર્યવાહી કરી સદર અરજીઓનો નિકાલ કરવો / મંડપ બાંધવાની પરમીશન આપવી.</li> <li>➢ સદર પરમીશન બાબતે નિયત મંડપ ફીની વસુલાત કરવી.</li> <li>➢ સન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ ગોપીતળાવના ભાડાની વસુલાતની કામગીરી કરવી.</li> <li>➢ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આવેલ કેન્ટીનના ઈજારા તેમજ ભાડા રીકવરી અંગેની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરોક્ત તમામની સ્થળતપાસની કામગીરી કરવી.</li> <li>➢ ઝોન કક્ષાએથી સમયાંતરે સોંપવામાં આવતી વિવિધ ઓર્ડરો અંગેની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરી અધિકારીશ્રી ધ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી કરવી.</li> </ul>
૫.	ત્રીજી શ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ સુરત મહાનગર પાલિકા ધ્વારા કરવામાં આવતી જાહેરાત અન્વયે લાયસન્સ ફીમાંથી મજરે આપવાની કામગીરી કરવી.</li> <li>➢ હોર્ડિંગની રીકવરીની વસુલાત કરવી.</li> <li>➢ હોર્ડિંગ અંગેની ફરીયાદોનો નિકાલ કરવો.</li> <li>➢ હોર્ડિંગના ટેન્ડર બહાર પાડવાની કામગીરી કરવી.</li> <li>➢ પે એન્ડ પાર્કના ટેન્ડર બહાર પાડવાની કામગીરી કરવી.</li> <li>➢ નવા હોર્ડિંગસા પરમીશન આપવાની તથા રીન્યુઅલની કામગીરી કરવી.</li> <li>➢ હોર્ડિંગ અન્વયે આવેલ અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ હોર્ડિંગ અન્વયે આવેલ આર.ટી.આઈ. અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ ઝોન કક્ષાએથી સમયાંતરે સોંપવામાં આવતી વિવિધ ઓર્ડરો અંગેની કામગીરી કરવી.</li> <li>➢ જાહેર જનતા ધ્વારા સુરત મહાનગરપાલિકા પર કરવામાં આવતાં હોર્ડિંગસ બાબતની કોર્ટ કેસ અંગેની કામગીરી કરવી.</li> <li>➢ હોર્ડિંગ અને પે એન્ડ પાર્કના સ્થળતપાસની કામગીરી કરવી.</li> <li>➢ ચુંટણી પંચ ધ્વારા નિયુક્ત કરેલ જે—તે વિધાનસભા મતવિસ્તારમાં નિયત કરેલ ભાગમાં બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) તરીકે સોંપવામાં આવેલ તમામ કામગીરી કરવી.</li> <li>➢ ઉપરી અધિકારીશ્રી ધ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી કરવી.</li> </ul>
૬	ત્રીજી શ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ સુરત મહાનગર પાલિકા ધ્વારા કરવામાં આવતી જાહેરાત અન્વયે લાયસન્સ ફીમાંથી મજરે આપવાની કામગીરી કરવી.</li> <li>➢ હોર્ડિંગની રીકવરીની વસુલાત કરવી.</li> <li>➢ હોર્ડિંગ અંગેની ફરીયાદોનો નિકાલ કરવો.</li> <li>➢ હોર્ડિંગના ટેન્ડર બહાર પાડવાની કામગીરી કરવી.</li> <li>➢ પે એન્ડ પાર્કના ટેન્ડર બહાર પાડવાની કામગીરી કરવી.</li> <li>➢ નવા હોર્ડિંગસા પરમીશન આપવાની તથા રીન્યુઅલની કામગીરી કરવી.</li> <li>➢ હોર્ડિંગ અન્વયે આવેલ અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ હોર્ડિંગ અન્વયે આવેલ આર.ટી.આઈ. અરજીઓનો નિકાલ કરવો.</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<ul style="list-style-type: none"> <li>➢ જોન કશાએથી સમયાંતરે સોંપવામાં આવતી વિવિધ ઓર્ડરો અંગેની કામગીરી કરવી.</li> <li>➢ જાહેર જનતા ધ્વારા સુરત મહાનગરપાલિકા પર કરવામાં આવતાં હોર્ડિંગ્સ બાબતની કોર્ટ કેસ અંગેની કામગીરી કરવી.</li> <li>➢ હોર્ડિંગ્સ અને પે એન્ડ પાર્કના સ્થળતપાસની કામગીરી કરવી.</li> <li>➢ ચુંટણી પંચ ધ્વારા નિયુક્ત કરેલ જે—તે વિધાનસભા મતવિસ્તારમાં નિયત કરેલ ભાગમાં બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) તરીકે સોંપવામાં આવેલ તમામ કામગીરી કરવી.</li> <li>➢ ઉપરી અધિકારીશ્રી ધ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી કરવી.</li> </ul>
૭.	ત્રીજી શ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૩૧ લોકેશનો પર આવેલ મ્યુ.શોપીગ સેન્ટરોની કુલ ૩૪૨ દુકાનોના સુપરવિઝન તેમજ મોનીટરીંગની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરોક્ત દુકાનોના ભાડાની વસુલાતની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરોક્ત દુકાનો સંબંધિત આવેલ અરજીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરી સદર અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ ઉપરોક્ત દુકાનો સંબંધિત આવેલ આર.ટી.આઈ. એક્ટ હેઠળની અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ ઉપરોક્ત દુકાનોના ભાડાપડ્યા રીન્યુઅલની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરોક્ત દુકાનો અન્વયે નામફેર અરજી અન્વયે યોગ્ય કાર્યવાહી કરી ભાડુતોના નામ ટ્રોન્સફર કરવા.</li> <li>➢ ઉપરોક્ત દુકાનોને લાગત અન્ય તમામ આનુષ્ઠાનિક કામગીરીઓ કરવી.</li> <li>➢ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૨૨ લોકેશનો પર આવેલ હોકીગ ઝોનની કુલ ૬૨ લારીઓના સુપરવિઝન તેમજ મોનીટરીંગની કામગીરી કરવી.</li> <li>➢ સદર લારીઓ અંગે આવેલ અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ સદર લારીઓના ભાડાની વસુલાત કરવી.</li> <li>➢ સદર લારીઓ અન્વયે નામફેર અરજી અન્વયે યોગ્ય કાર્યવાહી કરી ભાડુતોના નામ ટ્રોન્સફર કરવા.</li> <li>➢ સદર લારીઓ સંબંધિત આવેલ આર.ટી.આઈ. એક્ટ હેઠળની અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૧ લોકેશનો પર આવેલ વિધવા / વિકલાંગ કેબીનોના સુપરવિઝન તેમજ મોનીટરીંગની કામગીરી કરવી.</li> <li>➢ સદર કેબીનો અંગે આવેલ અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ સદર કેબીનોના ભાડાની વસુલાત કરવી.</li> <li>➢ સદર કેબીનો અન્વયે નામફેર અરજી અન્વયે યોગ્ય કાર્યવાહી કરી ભાડુતોના નામ ટ્રોન્સફર કરવા.</li> <li>➢ ઉપરોક્ત કેબીનો સંબંધિત આવેલ આર.ટી.આઈ. એક્ટ હેઠળની અરજીઓનો નિકાલ કરવો.</li> <li>➢ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં શહેરીજનો ધ્વારા વિવિધ તહેવારો / પ્રસંગો નિમિત્તે બાંધવામાં આવતાં મંડપો અંગે આવતી અરજીઓ અન્વયે યોગ્ય કાર્યવાહી કરી સદર અરજીઓનો નિકાલ કરવો / મંડપ બાંધવાની પરમીશન આપવી.</li> <li>➢ સદર પરમીશન બાબતે નિયત મંડપ ફીની વસુલાત કરવી.</li> <li>➢ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ ગોપીતળાવના ભાડાની વસુલાતની કામગીરી કરવી.</li> <li>➢ ચુંટણી પંચ ધ્વારા નિયુક્ત કરેલ જે—તે વિધાનસભા મતવિસ્તારમાં નિયત કરેલ ભાગમાં બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) તરીકે સોંપવામાં આવેલ તમામ કામગીરી કરવી.</li> <li>➢ ઉપરોક્ત તમામની સ્થળતપાસની કામગીરી કરવી.</li> <li>➢ ઝોન કશાએથી સમયાંતરે સોંપવામાં આવતી વિવિધ ઓર્ડરો અંગેની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરી અધિકારીશ્રી ધ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી કરવી.</li> </ul>
૮.	ત્રીજી શ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૩૪ લોકેશનો પર આવેલ પે એન્ડ પાર્કના ટેન્ડરીંગને લગતી કામગીરી કરવી.</li> <li>➢ પે એન્ડ પાર્કના મંજૂર થયેલ કામ અંગે ઈજારદાર પાસે પર્ફોર્માન્સ</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
		<p>ઉપોઝીટ અને સીક્યુરિટી ઉપોઝીટની રકમની વસુલાત કરવી.</p> <ul style="list-style-type: none"> <li>➢ સદર પે એન્ડ પાર્કના એલોટમેન્ટ લેટર અને વર્કઓર્ડર આપવાની કામગીરી કરવી.</li> <li>➢ દર માસે નિયત લાયસન્સ ફીની વસુલાતની કામગીરી કરવી.</li> <li>➢ દરેક ઈજારદાર સાથે એગ્રીમેન્ટ કરાવવાની કામગીરી કરવી.</li> <li>➢ દરેક પે એન્ડ પાર્કની વિઝીટ કરવી અને ત્યાં જો કોઈ ક્ષતિ માલુમ પડે તો તે અંગેની ઈજારદારને નોટીસ આપવાની કામગીરી કરવી.</li> <li>➢ ઈજારદારને આપવામાં આવેલ નોટીસ અંગે દંડ વસુલાતની કરવાની કામગીરી કરવી.</li> <li>➢ જમીન મિલકત વિભાગ તેમજ ચોમાસુ ઈમરજન્સી સ્ટાફના હાજરીના ડેટા તૈયાર કરવાની કામગીરી કરવી.</li> <li>➢ ચુંટણી પંચ ધ્વારા નિયુક્ત કરેલ જે—તે વિધાનસભા મતવિસ્તારમાં નિયત કરેલ ભાગમાં બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) તરીકે સોપવામાં આવેલ તમામ કામગીરી કરવી.</li> <li>➢ ઝોન કક્ષાએથી સમયાંતરે સોપવામાં આવતી વિવિધ ઓર્ડરો અંગેની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરી અધિકારીશ્રી ધ્વારા સોપવામાં આવતી અન્ય કામગીરી કરવી.</li> </ul>
૯.	પટાવાળા	<ul style="list-style-type: none"> <li>➢ જુદા જુદા દસ્તાવેજો / રેકર્ડના ફાઇલીંગની કામગીરી કરવી.</li> <li>➢ જુદા જુદા દસ્તાવેજો / રેકર્ડના જેરોક્ષને લગતી કામગીરી કરવી.</li> <li>➢ વિભાગને લગતી તમામ પ્રકારની ટપાલ લાવવા તથા લઈ જવાની કામગીરી</li> <li>➢ વિભાગની જરૂરીયાત મુજબની સ્ટેશનરી લાવવાની કામગીરી કરવી.</li> <li>➢ ઉપરી અધિકારીશ્રીની સુચના મુજબ તેઓ સાથે ફિલ્ડ વિઝીટ કરવાની કામગીરી કરવી.</li> </ul>
૧૦.	પટાવાળા	<ul style="list-style-type: none"> <li>➢ જુદા જુદા દસ્તાવેજો / રેકર્ડના ફાઇલીંગની કામગીરી કરવી.</li> <li>➢ જુદા જુદા દસ્તાવેજો / રેકર્ડના જેરોક્ષને લગતી કામગીરી કરવી.</li> <li>➢ વિભાગને લગતી તમામ પ્રકારની ટપાલ લાવવા તથા લઈ જવાની કામગીરી</li> <li>➢ વિભાગની જરૂરીયાત મુજબની સ્ટેશનરી લાવવાની કામગીરી કરવી.</li> </ul>
<b>આર.ટી.આઈ વિભાગ</b>		
<p>સુરત મહાનગરપાલિકામાં સેન્ટ્રલ્ઝોન આર.ટી.આઈ. ખાતાની જરૂરીયાતનો વિચાર કરી ખાતાની શરૂઆત લગભગ ૨૦૦૫ થી કરવામાં આવી છે. શરૂઆતનાં વર્ષમાં આર.ટી.આઈ. ખાતામાં એક બીજી શ્રેણી કલાર્ક અને એક કોમ્પ્યુટર ઓપરેટર તથા એક પટાવાળાની નિમણુંક કરવામાં આવી હતી. તે પછી કામગીરીનાં ભારણને ધ્યાનમાં લઈ એક તાલીમાર્થી નીજી શ્રેણી કલાર્કની નિમણુંક કરવામાં આવી હતી. હાલમાં સેન્ટ્રલ્ઝોન આર.ટી.આઈ. ખાતામાં એક બીજી શ્રેણી કલાર્ક, એક નીજી શ્રેણી કલાર્ક, એક તાલીમાર્થી નીજી શ્રેણી કલાર્ક, એક કોમ્પ્યુટર ઓપરેટર તથા બે પટાવાળા ફરજ બજાવી રહ્યા છે. સેન્ટ્રલ્ઝોન આર.ટી.આઈ. ખાતાની મુખ્યત્વે કામગીરીમાં સેન્ટ્રલ્ઝોનનાં તમામ ખાતાઓની નાગરિક સુવિધા કેન્દ્રમાંથી આવેલ અરજીઓ સ્વીકારી નોંધણી કરી લાગત ખાતામાં મોકલવી તેમજ પ્રથમ અપીલ સ્વીકારી, નોંધણી કરી, હુકમો તૈયાર કરવા તથા બીજી અપીલની કામગીરી અંગે આયોગ સાથે સંકલન કરી પૂર્તતા કરવી અથવા સુનાવણી માટેની કાર્યવાહી કરવી. અને ઓનલાઈન અરજી, પ્રથમ અપીલ, બીજી અપીલ સ્વીકારવી તેમજ તેનો નિકાલ કરવો વિગેરે સેન્ટ્રલ ઝોનનાં આર.ટી.આઈ. ખાતા ધ્વારા કામગીરી કરવામાં આવે છે.</p>		
(૧)	બીજી શ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ સિવિક સેન્ટર તથા તમામ ઝોન/ખાતાઓમાંથી આવતી અરજીઓ રીસીવ કરી નિકાલ કરવાની તમામ કામગીરી.</li> <li>➢ તમામ આઈ.ડી. અરજીઓ ઈનવર્ડ કરવી.</li> <li>➢ તબદીલ કરવા જોગ આઈ.ડી. અરજીઓ લાગત જાહેર માહિતી અધિકારીશ્રીને /અન્ય ખાતા / ઝોનને તબદીલ કરવી તેમજ તેને સંલગ્ન રજીસ્ટરો નિભાવવાની કામગીરી .</li> <li>➢ અરજીઓનો ઓનલાઈન માસિક અને ત્રિમાસિક અહેવાલ તૈયાર કરવાની કામગીરી.</li> <li>➢ આર.ટી.આઈ. ખાતાની તમામ કામગીરીનું સંકલન કરવું.</li> </ul>

	કર્મચારીનું નામ અને હોદ્દો	સત્તા અને કાર્યક્ષેત્ર
(૨)	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ આયોગમાંથી આવેલ બીજી અપીલને લગતી તમામ કામગીરી.</li> <li>➢ પ્રથમ અપીલ સ્વીકારી, નોંધણી કરવી, આર.ટી.આઈ. હેઠળ આવેલ અપીલ અરજીઓને સંબંધિત અધિકારીને મોકલવા, તે મોકલવા, તે અંગેના જવાબો / હુકમો તૈયાર કરવા / કરાવવા / અન્ય વિભાગ કે જોનને તબદીલ કરવા તેમજ તેને આનુસંગિક તમામ કામગીરીઓ.</li> <li>➢ અપીલનાં ઓનલાઈન માસિક અને ત્રિમાસિક અહેવાલ તૈયાર કરવાની કામગીરી.</li> </ul>
(૩)	તાલી.ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	<ul style="list-style-type: none"> <li>➢ આર.ટી.આઈ. ની અરજી સંદર્ભે થયેલા જવાબો મોકલવા, જવાબોની ખતવણી તેમજ રેકર્ડની સાચવણી / જાળવણીની કામગીરી</li> </ul>
(૪)	પટાવણા / બેલદાર	<ul style="list-style-type: none"> <li>➢ સ્ટેશનરી તથા અન્ય ચીજ વસ્તુ લાવવાની કામગીરી રીપોર્ટ ફાઈલીંગ અંગેની કામગીરી.</li> <li>➢ ઉપલા અધિકારીશ્રી દ્વારા સૌંપવામાં આવતી તમામ કામગીરી.</li> </ul>

ઉપરોક્ત બાબતે જરૂરી વિગતો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ [www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in) ઉપર ઉપલબ્ધ છે જે અવલોકનમાં લેવા વિનંતી.

## સામાન્ય બાબત

સુરત મહાનગરપાલિકાનો સમગ્ર વહીવટ અને કામગીરી અલગ અલગ ખાતાઓમાં વહેંચાયેલ છે જેથી ખાતાવાર જે તે કર્મચારીઓને જે તે ખાતામાં ચાલતા કામ અનુસાર કામગીરી કરવાની રહે છે. પરંતુ સામાન્ય રીતે કર્મચારીઓ તેઓની કેડર અનુસાર કામગીરી સૌંપવામાં આવે છે ત્રીજી શ્રેષ્ઠી કલાર્કને તેમની કેડરને અનુરૂપ કામગીરી તેમજ બીજી શ્રેષ્ઠી કલાર્કને તેમની કેડરને અનુરૂપ કામગીરી સૌંપવામાં આવે છે, જુદા જુદા ખાતામાં જુદા જુદા પ્રકારની કામગીરી જે તે કર્મચારીને સૌંપવામાં આવે તે જે તે કર્મચારીએ વિના સંકોચે સ્વીકારી લેવી જોઈએ. તે તેમની પ્રાથમિક ફરજ છે અને જે બાબતમાં

કર્મચારીને સમજ ન પડે અગાર તો અજાણ હોય તો તે બાબતનું માર્ગદર્શન કર્મચારીઓએ ઉપરી અધિકારી તરફથી મેળવી લેવું જોઈએ અને બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વિસંગતતા ઉભી ન થાય તથા સહજ અને સુગમ રીતે કામગીરી થાય તેવો કર્મચારીએ પ્રયત્ન કરવો જોઈએ, એવો અભિગમ રાખવો જોઈએ.